

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ



ገጽ 41 ላይ የገጽ 94 ላይ የገጽ 3 ላይ የገጽ 24 ላይ የገጽ 2012 ላይ የገጽ 1433 ላይ የገጽ 1

ገጽ 41 ላይ የገጽ 94 ላይ የገጽ 3 ላይ የገጽ 24 ላይ የገጽ 2012 ላይ የገጽ 1433 ላይ የገጽ 1

144	ገጽ 3	ገጽ 34	ገጽ 61	ገጽ 62	ገጽ 63
157	ገጽ 34	ገጽ 61	ገጽ 62	ገጽ 63	ገጽ 63
160	ገጽ 61	ገጽ 62	ገጽ 63	ገጽ 63	ገጽ 63
161	ገጽ 62	ገጽ 63	ገጽ 63	ገጽ 63	ገጽ 63
181	ገጽ 63	ገጽ 63	ገጽ 63	ገጽ 63	ገጽ 63

- የገጽ 1 ላይ የገጽ 3 ላይ የገጽ 24 ላይ የገጽ 2012 ላይ የገጽ 1433 ላይ የገጽ 1
- የገጽ 3 ላይ የገጽ 34 ላይ የገጽ 61 ላይ የገጽ 62 ላይ የገጽ 63 ላይ የገጽ 63
- የገጽ 34 ላይ የገጽ 61 ላይ የገጽ 62 ላይ የገጽ 63 ላይ የገጽ 63
- የገጽ 61 ላይ የገጽ 62 ላይ የገጽ 63 ላይ የገጽ 63
- የገጽ 62 ላይ የገጽ 63 ላይ የገጽ 63 ላይ የገጽ 63
- የገጽ 63 ላይ የገጽ 63 ላይ የገጽ 63 ላይ የገጽ 63

ገጽ 41 ላይ የገጽ 94 ላይ የገጽ 3 ላይ የገጽ 24 ላይ የገጽ 2012 ላይ የገጽ 1433 ላይ የገጽ 1

ገጽ 34 ላይ የገጽ 61 ላይ የገጽ 62 ላይ የገጽ 63 ላይ የገጽ 63

ገጽ 61 ላይ የገጽ 62 ላይ የገጽ 63 ላይ የገጽ 63

ገጽ 62 ላይ የገጽ 63 ላይ የገጽ 63 ላይ የገጽ 63

ገጽ 63 ላይ የገጽ 63 ላይ የገጽ 63 ላይ የገጽ 63

ገጽ 63 ላይ የገጽ 63 ላይ የገጽ 63 ላይ የገጽ 63

Gan International Airport Pvt. Ltd

29th April 2012

INVITATION FOR EXPRESSION OF INTEREST FOR SEEKING CONTRACTOR FOR THE GAN AIRPORT RUNWAY / APRON EXTENSION AND REHABILITATION PROJECT

1. Key Objective – Addu International Airport Pvt. Ltd., a company incorporated under the laws of the Republic of Maldives, with shareholding by Gan Airport Company Ltd (GACL), State Trading Organization Plc (STO), Maldives Airports Company Ltd (MACL), and the Government of Maldives (GOM) having its registered address at Ministry of Finance and Treasury, Ameen Magu, Male, Republic of Maldives (hereinafter referred to as “AIA”), was formed as a consortium of the above four parties for the purpose of developing, managing; operating either on its own or by way of third party engagements, Gan Airport as an International Airport and develop any and all ancillary or related facilities in the same manner together with the airport. AIA is now seeking competent contractor/s who would be interested in undertaking this project as a contractor-financed project. Expression of Interest is welcome from local and/or international parties with relevant financial / technical / contracting record.
2. Upon receipt of expression of interest a preliminary evaluation based on the background and capacity of the parties will be conducted and a short-listing / Pre-qualification will be done.
3. Shortlisted / pre-qualified parties will then be provided with detailed technical requirements and final tender submission documents. Interested shortlisted parties will be allowed to submit a detailed project tender at a time and date to be pre-informed to the parties. A final selection of the contractor will be based on the results of the evaluation of the submitted tender.

Nature of engagement

To undertake the technical studies and subsequently the civil works that is required for captioned project. The components in the project include:

1. Drainage System to Runway and Apron
2. Water Runway for Sea plane Operation
3. Runway Extension Reclamation
4. Runway Construction on Extension
5. Perimeter Road around Extension
6. Overlay on existing Runway and Taxiways
7. Runway Shoulders
8. Existing Apron Refurbishment
9. Approach Lights and Landing Aids

Submission guidelines

- a. Contact details – full address; contact person(s),
- b. Detailed profile of the commercial entity
- c. Details of relevant experience
- d. Demonstrate ability to obtain funding for development in the short/medium/long term (based on own funds, BS strength, financial contacts)
- e. Provide an executive summary of the strategic plan envisaged for the project (not longer than 10 pages)
- f. Expression of Interest to be sent electronically or in print by on/or before:
- g. 28th May 2012 to:

Managing Director
Addu International Airport Pvt. Ltd
C/o State Trading Organization Plc. Head Office
Boduthakurufaanu Magu,
Male, Maldives
Tel: (960) 334 4222, (960) 334 4324, Fax (960) 334 4335
Email: shahidali@stomaldives.net

למחלקת המשפטים
ד"ר, פרופ' יעקב

מס' 145-A/2012/32

התביעה

התביעה נגד משרד המשפטים ונגד שירות המבחן
145-A/2012/25 מס' 145-A/2012/25
(30-04-2012) 145-A/2012/27 מס' 145-A/2012/27
(06-05-2012) 145-A/2012/27 מס' 145-A/2012/27
29 ע'ד קצ' 1433
20 יולי 2012

למחלקת המשפטים
ד"ר, פרופ' יעקב

מס' BAM/IUL/2012/23

התביעה

התביעה נגד משרד המשפטים ונגד שירות המבחן
2012 יולי 30 מס' 03
14:00 27 יולי 2012
21 יולי 2012

למחלקת המשפטים
ד"ר, פרופ' יעקב

מס' MBC-F/IU/2012/40

התביעה

התביעה נגד משרד המשפטים ונגד שירות המבחן
1433 29 ע'ד קצ' 2012

מס' התביעה	תיאור התביעה
1	התביעה נגד משרד המשפטים ונגד שירות המבחן
2	התביעה נגד משרד המשפטים ונגד שירות המבחן (מס' 145-A/2012/25)
3	התביעה נגד משרד המשפטים ונגד שירות המבחן (מס' 145-A/2012/27)
4	התביעה נגד משרד המשפטים ונגד שירות המבחן (מס' 145-A/2012/27)
5	התביעה נגד משרד המשפטים ונגד שירות המבחן (מס' 145-A/2012/27)
6	התביעה נגד משרד המשפטים ונגד שירות המבחן

התביעה נגד משרד המשפטים ונגד שירות המבחן
2012 יולי 27 מס' 03
14:00 27 יולי 2012
21 יולי 2012

29 ע'ד קצ' 1433
20 יולי 2012

ዕርጋና ወይንም ባህሪ ጥያቄ
አዲስ አበባ

የመንግሥት ስም: ADM-MPL/2012/72

ዕድገት

የአስተዳደር ስልጠና

በደብዳቤው አካባቢ ላይ ለሚኖሩ ጥሪዎች ላይ የሚሰጡ ስልጠናዎች ለማስፈጸም
የሚደረግ ስልጠና የሚኖሩ ጥሪዎች ላይ ለሚኖሩ ጥሪዎች ላይ የሚሰጡ ስልጠናዎች ለማስፈጸም
ዎን፣ በግልጽ ለሚኖሩ ጥሪዎች ላይ ለሚኖሩ ጥሪዎች ላይ የሚሰጡ ስልጠናዎች ለማስፈጸም
30 ኃይር 2012 ወይንም ጥያቄው 14:00 ሰዓት ባደረገው
ወይንም ሰዓት 3 ሰዓት ለሚኖሩ ጥሪዎች ላይ ለሚኖሩ ጥሪዎች ላይ የሚሰጡ ስልጠናዎች ለማስፈጸም
05 ኃይር 2012 ወይንም ሰዓት 14:00 ሰዓት ባደረገው
14:00 ሰዓት ባደረገው ወይንም ሰዓት 3 ሰዓት ለሚኖሩ ጥሪዎች ላይ ለሚኖሩ ጥሪዎች ላይ የሚሰጡ ስልጠናዎች ለማስፈጸም
ወይንም ሰዓት ለሚኖሩ ጥሪዎች ላይ ለሚኖሩ ጥሪዎች ላይ የሚሰጡ ስልጠናዎች ለማስፈጸም

03 ጥያቄ 1433

24 ኃይር 2012

ዕርጋና ወይንም ባህሪ ጥያቄ
አዲስ አበባ

የመንግሥት ስም: (IUL)A-2012/11

ዕድገት

የሰነድ ስራ

በደብዳቤው አካባቢ ላይ ለሚኖሩ ጥሪዎች ላይ የሚሰጡ ስራዎች ለማስፈጸም
የሚደረግ ስራ የሚኖሩ ጥሪዎች ላይ ለሚኖሩ ጥሪዎች ላይ የሚሰጡ ስራዎች ለማስፈጸም
ዎን፣ በግልጽ ለሚኖሩ ጥሪዎች ላይ ለሚኖሩ ጥሪዎች ላይ የሚሰጡ ስራዎች ለማስፈጸም
04 ኃይር 2012 ወይንም ጥያቄው 11:30 ሰዓት ባደረገው
ወይንም ሰዓት 11:30 ሰዓት ለሚኖሩ ጥሪዎች ላይ ለሚኖሩ ጥሪዎች ላይ የሚሰጡ ስራዎች ለማስፈጸም
11:30 ሰዓት ባደረገው ወይንም ሰዓት ለሚኖሩ ጥሪዎች ላይ ለሚኖሩ ጥሪዎች ላይ የሚሰጡ ስራዎች ለማስፈጸም

30 ኃይር ጥያቄ 1433

21 ኃይር 2012

ዕርጋና ወይንም ባህሪ ጥያቄ
አዲስ አበባ

የመንግሥት ስም: B-386/2012/18

ዕድገት

የሰነድ ስራ

በደብዳቤው አካባቢ ላይ ለሚኖሩ ጥሪዎች ላይ የሚሰጡ ስራዎች ለማስፈጸም
የሚደረግ ስራ የሚኖሩ ጥሪዎች ላይ ለሚኖሩ ጥሪዎች ላይ የሚሰጡ ስራዎች ለማስፈጸም
ዎን፣ በግልጽ ለሚኖሩ ጥሪዎች ላይ ለሚኖሩ ጥሪዎች ላይ የሚሰጡ ስራዎች ለማስፈጸም
2800 ሰነድ (ወይንም ሰዓት) የሚኖሩ ጥሪዎች ላይ ለሚኖሩ ጥሪዎች ላይ የሚሰጡ ስራዎች ለማስፈጸም
800 ሰነድ
1000 ሰነድ
1000 ሰነድ
03 ኃይር 2012 ወይንም ጥያቄው ሰዓት ለሚኖሩ ጥሪዎች ላይ ለሚኖሩ ጥሪዎች ላይ የሚሰጡ ስራዎች ለማስፈጸም
12 ኃይር 2012 ወይንም ሰዓት ለሚኖሩ ጥሪዎች ላይ ለሚኖሩ ጥሪዎች ላይ የሚሰጡ ስራዎች ለማስፈጸም
7776090, 6780715, 7784475 የሚኖሩ ጥሪዎች ላይ ለሚኖሩ ጥሪዎች ላይ የሚሰጡ ስራዎች ለማስፈጸም

21 ኃይር 2012

סוכנות התעבורה והביטחון בדרכים
דירת: 372-D/2012/20

סוכנות התעבורה והביטחון בדרכים

הודעה

הודעה על פיקוח

הודעה על פיקוח נהגים ונהגות אשר נדרש להם להשתתף בקורס הכשרה מיוחדת. הקורס יתקיים ב-14 ביולי 2012 בשעה 14:00 בבוקר במועדון הספורט "הירוק" ברחוב יפו 14, תל אביב. המשתתפים יצוידו עם תעודת זהות ורישיון נהיגה. עלות הקורס היא 100 ש"ח. להגשת מועמדות יש לפנות למספר הטלפון 03-6222222.

תנאים להשתתפות בקורס

- 1- יש להגיש מועמדות לפני תחילת הקורס.
- 2- יש להגיש תעודת זהות ותמונה.
- 3- יש להגיש רישיון נהיגה.
- 4- יש להגיש תעודת זהות ותמונה.
- 5- יש להגיש רישיון נהיגה.

התנאים להשתתפות בקורס יפורסמו באתר האינטרנט של הסוכנות.

מספר: 85

מספר: 85 / מספר: 85

מספר: 10

מספר: 10 / מספר: 10

מספר: 5

התנאים להשתתפות בקורס יפורסמו באתר האינטרנט של הסוכנות.

הודעה על פיקוח נהגים ונהגות אשר נדרש להם להשתתף בקורס הכשרה מיוחדת. הקורס יתקיים ב-14 ביולי 2012 בשעה 14:00 בבוקר במועדון הספורט "הירוק" ברחוב יפו 14, תל אביב. המשתתפים יצוידו עם תעודת זהות ורישיון נהיגה. עלות הקורס היא 100 ש"ח. להגשת מועמדות יש לפנות למספר הטלפון 03-6222222.

26 יולי 2012

20 יולי 2012

הודעה על פיקוח נהגים ונהגות אשר נדרש להם להשתתף בקורס הכשרה מיוחדת. הקורס יתקיים ב-14 ביולי 2012 בשעה 14:00 בבוקר במועדון הספורט "הירוק" ברחוב יפו 14, תל אביב. המשתתפים יצוידו עם תעודת זהות ורישיון נהיגה. עלות הקורס היא 100 ש"ח. להגשת מועמדות יש לפנות למספר הטלפון 03-6222222.

سرپرست کارخانه و مدیر عامل در خصوص گزارش کارشناسان فنی و مهندسی
در خصوص گزارش کارشناسان فنی و مهندسی

شماره سند: 372-D/2012/21

موضوع

در خصوص گزارش کارشناسان فنی و مهندسی

این گزارش در تاریخ 02 شهریور ماه 1391 در خصوص گزارش کارشناسان فنی و مهندسی
در خصوص گزارش کارشناسان فنی و مهندسی در خصوص گزارش کارشناسان فنی و مهندسی
در خصوص گزارش کارشناسان فنی و مهندسی

در خصوص گزارش کارشناسان فنی و مهندسی در خصوص گزارش کارشناسان فنی و مهندسی
در خصوص گزارش کارشناسان فنی و مهندسی در خصوص گزارش کارشناسان فنی و مهندسی
در خصوص گزارش کارشناسان فنی و مهندسی در خصوص گزارش کارشناسان فنی و مهندسی

در خصوص گزارش کارشناسان فنی و مهندسی

- 1- به منظور تعیین وضعیت کارخانه در خصوص گزارش کارشناسان فنی و مهندسی
- 2- به منظور تعیین وضعیت کارخانه در خصوص گزارش کارشناسان فنی و مهندسی
- 3- به منظور تعیین وضعیت کارخانه در خصوص گزارش کارشناسان فنی و مهندسی
- 4- به منظور تعیین وضعیت کارخانه در خصوص گزارش کارشناسان فنی و مهندسی
- 5- به منظور تعیین وضعیت کارخانه در خصوص گزارش کارشناسان فنی و مهندسی

در خصوص گزارش کارشناسان فنی و مهندسی

تاریخ: 85 شهریور

شماره سند: 85 / شهریور / 1391

تاریخ: 10 شهریور

شماره سند: 10 / شهریور / 1391

تاریخ: 5 شهریور

در خصوص گزارش کارشناسان فنی و مهندسی

در خصوص گزارش کارشناسان فنی و مهندسی در خصوص گزارش کارشناسان فنی و مهندسی
در خصوص گزارش کارشناسان فنی و مهندسی در خصوص گزارش کارشناسان فنی و مهندسی
در خصوص گزارش کارشناسان فنی و مهندسی در خصوص گزارش کارشناسان فنی و مهندسی

26 شهریور 1433

20 شهریور 2012

در خصوص گزارش کارشناسان فنی و مهندسی در خصوص گزارش کارشناسان فنی و مهندسی
در خصوص گزارش کارشناسان فنی و مهندسی در خصوص گزارش کارشناسان فنی و مهندسی

دۇئا بىيە نازىرىيەسى تەرىپىدىن

دۇئا تەييارلىغان

سىرتقى مەزمەن: (IUL) 425-CB/1/2012/103

ناھايىتى

خۇجۇمىيەت بىيە نازىرىيەسى تەرىپىدىن تەييارلانغان:

بۇ تەييارلىق 11 دېكەمبەر 2012 (IUL) 425-A2/1/2012/45 نىڭ بىيە نازىرىيەسى تەرىپىدىن تەييارلىنىشىغا ئىگە. 2012 يىلى 31 دېكەمبەردە بىيە نازىرىيەسى تەرىپىدىن تەييارلىنىشىغا ئىگە. بۇ تەييارلىق 14:00 سائەتتە بىيە نازىرىيەسى تەرىپىدىن تەييارلىنىشىغا ئىگە. بۇ تەييارلىق 14:00 سائەتتە بىيە نازىرىيەسى تەرىپىدىن تەييارلىنىشىغا ئىگە.

بۇ تەييارلىق 14:00 سائەتتە بىيە نازىرىيەسى تەرىپىدىن تەييارلىنىشىغا ئىگە. بۇ تەييارلىق 14:00 سائەتتە بىيە نازىرىيەسى تەرىپىدىن تەييارلىنىشىغا ئىگە. بۇ تەييارلىق 14:00 سائەتتە بىيە نازىرىيەسى تەرىپىدىن تەييارلىنىشىغا ئىگە. بۇ تەييارلىق 14:00 سائەتتە بىيە نازىرىيەسى تەرىپىدىن تەييارلىنىشىغا ئىگە. بۇ تەييارلىق 14:00 سائەتتە بىيە نازىرىيەسى تەرىپىدىن تەييارلىنىشىغا ئىگە.

30 نۆجە تەييارلىنىشىغا ئىگە 1433
21 دېكەمبەر 2012

دۇئا بىيە نازىرىيەسى تەرىپىدىن

دۇئا تەييارلىغان

سىرتقى مەزمەن: 113-PRC/I-2012/65

ناھايىتى

بۇ تەييارلىق 11 دېكەمبەر 2012 (IUL) A-2012/11 نىڭ بىيە نازىرىيەسى تەرىپىدىن تەييارلىنىشىغا ئىگە. بۇ تەييارلىق 14:00 سائەتتە بىيە نازىرىيەسى تەرىپىدىن تەييارلىنىشىغا ئىگە. بۇ تەييارلىق 14:00 سائەتتە بىيە نازىرىيەسى تەرىپىدىن تەييارلىنىشىغا ئىگە. بۇ تەييارلىق 14:00 سائەتتە بىيە نازىرىيەسى تەرىپىدىن تەييارلىنىشىغا ئىگە.

01 نۆجە تەييارلىنىشىغا ئىگە 1433
22 دېكەمبەر 2012

دۇئا بىيە نازىرىيەسى تەرىپىدىن

دۇئا تەييارلىغان

سىرتقى مەزمەن: (IUL)A-2012/11

ناھايىتى

بۇ تەييارلىق 11 دېكەمبەر 2012 (IUL) A-2012/11 نىڭ بىيە نازىرىيەسى تەرىپىدىن تەييارلىنىشىغا ئىگە. بۇ تەييارلىق 11:30 سائەتتە بىيە نازىرىيەسى تەرىپىدىن تەييارلىنىشىغا ئىگە. بۇ تەييارلىق 11:30 سائەتتە بىيە نازىرىيەسى تەرىپىدىن تەييارلىنىشىغا ئىگە. بۇ تەييارلىق 11:30 سائەتتە بىيە نازىرىيەسى تەرىپىدىن تەييارلىنىشىغا ئىگە.

30 نۆجە تەييارلىنىشىغا ئىگە 1433
21 دېكەمبەر 2012

Ministry of Environment and Energy
Male', Republic of Maldives.

Ref No.: (IUL)138-ES1/138/2012/52
Date: 21st May 2012

REGIONAL DEVELOPMENT PROJECT PHASE-II – ADB LOAN 2170 MLD (SF)

REQUEST FOR PROPOSAL

COMMUNITY TRAINING

Ministry of Environment and Energy (MEE) with assistance from Asian Development Bank (ADB) intends procuring the services of an institute to conduct a community training program at provincial level. The bid submissions requested by Ministry of Housing and Environment's Advertisement No. (IUL) 18-FS1/138/2012/13 dated 25 January has been cancelled, thus MEE would like to seek interested parties to conduct this training program.

The main objective of the training is to identify and develop community groups at provincial level through awareness and capacity building programs.

MEE now invites interested eligible Parties to submit Technical and Financial Proposals in accordance with the Request for Proposals available from MEE.

Interested Parties may review the Request for Proposal from <http://www.mhe.gov.mv/v1/> and further information from the address below.

A Party will be selected in accordance with the selection criteria detailed out in the Request for Proposal documents.

Proposals must be delivered to the following address and the person below by 1100 hours (local time) before 4th June 2012 by regular mail.

Project Director
Regional Development Project – Phase –II, ADB Loan 2170 MLD (SF)
Ministry of Environment and Energy
Ameenee Magu, Maafannu
Male', Republic of Maldives
Tel: +960 3004300 Fax: +960 3004301
E-mail: secretariat@mhte.gov.mv
Web site: www.mhe.gov.mv

މިނިސްޓްރީ އޮފް އެންވައިރަންމަންޓް އަންދު އެނަޖީ
މާލެ، ރިޕުބްލިކް އޮފް މާލްދިވެހިރާއްޖެ.

Ref No.: (IUL)138-ES1/138/2012/54

Date: 21st May 2012

REGIONAL DEVELOPMENT PROJECT PHASE-II – ADB LOAN 2170 MLD (SF)

REQUEST FOR PROPOSAL

COMMUNITY TRAINING

Ministry of Environment and Energy (MEE) with assistance from Asian Development Bank (ADB) intends procuring the services of an institute to conduct a community training program at provincial level. The bid submissions requested by Ministry of Housing and Environment's Advertisement No. (IUL) 18-FS1/138/2012/13 dated 25 January has been cancelled, thus MEE would like to seek interested parties to conduct this training program.

The main objective of the training is to identify and develop community groups at provincial level through awareness and capacity building programs.

MEE now invites interested eligible Parties to submit Technical and Financial Proposals in accordance with the Request for Proposals available from MEE.

Interested Parties may review the Request for Proposal from <http://www.mhe.gov.mv/v1/> and further information from the address below.

A Party will be selected in accordance with the selection criteria detailed out in the Request for Proposal documents.

Proposals must be delivered to the following address and the person below by 1100 hours (local time) before 4th June 2012 by regular mail.

Project Director
Regional Development Project – Phase –II, ADB Loan 2170 MLD (SF)
Ministry of Environment and Energy
Ameenee Magu, Maafannu
Male', Republic of Maldives
Tel: +960 3004300 Fax: +960 3004301
E-mail: secretariat@mhte.gov.mv
Web site: www.mhe.gov.mv

Ministry of Environment and Energy
Male', Republic of Maldives.

Ref No.: (IUL)138-ES1/138/2012/54
Date: 21st May 2012

REGIONAL DEVELOPMENT PROJECT PHASE-II – ADB LOAN 2170 MLD (SF)

REQUEST FOR PROPOSAL

FINANCIAL MANAGEMENT TRAINING

Ministry of Environment and Energy (MEE) with assistance from Asian Development Bank (ADB) intends procuring the services of an institute to conduct a Financial Management Training programme for a selective group of candidates. The bid submissions requested by Ministry of Housing and Environment's Advertisement No. (IUL) 18-FS1/138/2012/12 dated 25 January has been cancelled, thus MEE would like to seek interested parties to conduct this training program.

The main objective of the training is to develop and enhance corporate skills and management for a selective group of candidates.

MEE now invites interested eligible Parties to submit Technical and Financial Proposals in accordance with the Request for Proposals available from MEE.

Interested Parties may review the Request for Proposal from <http://www.mhe.gov.mv/v1/> and further information from the address below.

A Party will be selected in accordance with the selection criteria detailed out in the Request for Proposal documents.

Proposals must be delivered to the following address and the person below by 1130 hours (local time) before 4th June 2012 by regular mail.

Project Director
Regional Development Project – Phase –II, ADB Loan 2170 MLD (SF)
Ministry of Environment and Energy
Ameenee Magu, Maafannu
Male', Republic of Maldives
Tel: +960 3004300 Fax: +960 3004301
E-mail: secretariat@mhte.gov.mv
Web site: www.mhe.gov.mv

Ministry of Environment and Energy
Male', Republic of Maldives.

Ref No.: (IUL)138-ES1/138/2012/53
Date: 21st May 2012

REGIONAL DEVELOPMENT PROJECT PHASE-II – ADB LOAN 2170 MLD (SF)

REQUEST FOR PROPOSAL

CORPORATE MANAGEMENT TRAINING

Ministry of Environment and Energy (MEE) with assistance from Asian Development Bank (ADB) intends procuring the services of an institute to conduct a Corporate Management Training programme for a selective group of candidates. The bid submissions requested by Ministry of Housing and Environment's Advertisement No. (IUL) 18-FS1/138/2012/10 dated 25 January has been cancelled, thus MEE would like to seek interested parties to conduct this training program.

The main objective of the training is to develop and enhance corporate skills and management for a selective group of candidates.

The MEE now invites interested eligible Parties to submit Technical and Financial Proposals in accordance with the Request for Proposals available from MEE.

Interested Parties may review the Request for Proposal from <http://www.mhe.gov.mv/v1/> and further information from the address below.

A Party will be selected in accordance with the selection criteria detailed out in the Request for Proposal documents.

Proposals must be delivered to the following address and the person below by 1115 hours (local time) before 4th June 2012 by regular mail.

Project Director
Regional Development Project – Phase –II, ADB Loan 2170 MLD (SF)
Ministry of Environment and Energy
Ameenee Magu, Maafannu
Male', Republic of Maldives
Tel: +960 3004300 Fax: +960 3004301
E-mail: secretariat@mhte.gov.mv
Web site: www.mhe.gov.mv

މުވަދަތުގެ ތެރޭގައި ސަރުކާރުގެ
މަޢުލޫމާތު ޖެނެރަލް

ސަރުކާރުގެ ތެރޭގައި: 171-FD(PU)/IUL/2012/37

އިތުރު ބަޔާން

އިތުރު ބަޔާން ބޭނުންކުރާ ގޮތުގައި

މި ބަޔާނުގައި ބަޔާންކުރާ ގޮތުގައި ސަރުކާރުގެ
މަޢުލޫމާތު ޖެނެރަލް ބޭނުންކުރާ ގޮތުގައި.

މި ބަޔާނުގައި ބަޔާންކުރާ ގޮތުގައި ސަރުކާރުގެ
މަޢުލޫމާތު ޖެނެރަލް ބޭނުންކުރާ ގޮތުގައި 2012 ވަ
އަހަރުގެ 31 ޖުލައި ގަވާއިދުގެ 13:00 ގަޑިއިރު ސަރުކާރުގެ
މަޢުލޫމާތު ޖެނެރަލް ބޭނުންކުރާ ގޮތުގައި 06 ޖޫން 2012 ވަ
އަހަރުގެ 13:00 ގަޑިއިރު ސަރުކާރުގެ
މަޢުލޫމާތު ޖެނެރަލް ބޭނުންކުރާ ގޮތުގައި ރަޢީދު ޖަނަބުލާ
މަޢުލޫމާތު ޖެނެރަލް ބޭނުންކުރާ ގޮތުގައި ސަރުކާރުގެ
މަޢުލޫމާތު ޖެނެރަލް ބޭނުންކުރާ ގޮތުގައި 13:00 ގަޑިއިރު ސަރުކާރުގެ
މަޢުލޫމާތު ޖެނެރަލް ބޭނުންކުރާ ގޮތުގައި.

01 ޖަނަބުލާ 1433

22 ޖުލައި 2012

އިތުރު ބަޔާން ބޭނުންކުރާ
މަޢުލޫމާތު ޖެނެރަލް

ސަރުކާރުގެ ތެރޭގައި: 24 ޖުލައި 2012

ސަރުކާރުގެ ތެރޭގައި: (IUL)IM-B/1/2012/38

އިތުރު ބަޔާން

އިތުރު ބަޔާން ބޭނުންކުރާ ގޮތުގައި

މި ބަޔާނުގައި ބަޔާންކުރާ ގޮތުގައި ސަރުކާރުގެ
މަޢުލޫމާތު ޖެނެރަލް ބޭނުންކުރާ ގޮތުގައި 2012 ވަ
އަހަރުގެ 31 ޖުލައި ގަވާއިދުގެ 13:00 ގަޑިއިރު ސަރުކާރުގެ
މަޢުލޫމާތު ޖެނެރަލް ބޭނުންކުރާ ގޮތުގައި 06 ޖޫން 2012 ވަ
އަހަރުގެ 13:00 ގަޑިއިރު ސަރުކާރުގެ
މަޢުލޫމާތު ޖެނެރަލް ބޭނުންކުރާ ގޮތުގައި ރަޢީދު ޖަނަބުލާ
މަޢުލޫމާތު ޖެނެރަލް ބޭނުންކުރާ ގޮތުގައި ސަރުކާރުގެ
މަޢުލޫމާތު ޖެނެރަލް ބޭނުންކުރާ ގޮތުގައި 13:00 ގަޑިއިރު ސަރުކާރުގެ
މަޢުލޫމާތު ޖެނެރަލް ބޭނުންކުރާ ގޮތުގައި.

މި ބަޔާނުގައި ބަޔާންކުރާ ގޮތުގައި ސަރުކާރުގެ
މަޢުލޫމާތު ޖެނެރަލް ބޭނުންކުރާ ގޮތުގައި 2012 ވަ
އަހަރުގެ 31 ޖުލައި ގަވާއިދުގެ 13:00 ގަޑިއިރު ސަރުކާރުގެ
މަޢުލޫމާތު ޖެނެރަލް ބޭނުންކުރާ ގޮތުގައި 06 ޖޫން 2012 ވަ
އަހަރުގެ 13:00 ގަޑިއިރު ސަރުކާރުގެ
މަޢުލޫމާތު ޖެނެރަލް ބޭނުންކުރާ ގޮތުގައި ރަޢީދު ޖަނަބުލާ
މަޢުލޫމާތު ޖެނެރަލް ބޭނުންކުރާ ގޮތުގައި ސަރުކާރުގެ
މަޢުލޫމާތު ޖެނެރަލް ބޭނުންކުރާ ގޮތުގައި 13:00 ގަޑިއިރު ސަރުކާރުގެ
މަޢުލޫމާތު ޖެނެރަލް ބޭނުންކުރާ ގޮތުގައި.

24 ޖުލައި 2012

އިތުރު ބަޔާން ބޭނުންކުރާ ގޮތުގައި
މަޢުލޫމާތު ޖެނެރަލް ބޭނުންކުރާ ގޮތުގައި
ސަރުކާރުގެ ތެރޭގައި ބަޔާންކުރާ ގޮތުގައި
މަޢުލޫމާތު ޖެނެރަލް

ފޯން: 3345187 (960)

ފޯން: 3334072 (960)

އިމެލް: col@mnu.edu.mv

ސަރުކާރުގެ ތެރޭގައި: (IUL)COL/1/2012/12

އިތުރު ބަޔާން

ސަރުކާރުގެ ތެރޭގައި / ބަޔާންކުރާ ގޮތުގައި

މި ބަޔާނުގައި ބަޔާންކުރާ ގޮތުގައި ސަރުކާރުގެ
މަޢުލޫމާތު ޖެނެރަލް ބޭނުންކުރާ ގޮތުގައި 2012 ވަ
އަހަރުގެ 28 ޖުލައި ގަވާއިދުގެ 14:30 ގަޑިއިރު ސަރުކާރުގެ
މަޢުލޫމާތު ޖެނެރަލް ބޭނުންކުރާ ގޮތުގައި 29 ޖުލައި 2012 ވަ
އަހަރުގެ 11:00 ގަޑިއިރު ސަރުކާރުގެ
މަޢުލޫމާތު ޖެނެރަލް ބޭނުންކުރާ ގޮތުގައި ރަޢީދު ޖަނަބުލާ
މަޢުލޫމާތު ޖެނެރަލް ބޭނުންކުރާ ގޮތުގައި ސަރުކާރުގެ
މަޢުލޫމާތު ޖެނެރަލް ބޭނުންކުރާ ގޮތުގައި 13:00 ގަޑިއިރު ސަރުކާރުގެ
މަޢުލޫމާތު ޖެނެރަލް ބޭނުންކުރާ ގޮތުގައި.

1. ބަޔާންކުރާ ގޮތުގައި

2. ސަރުކާރުގެ ތެރޭގައި ބަޔާންކުރާ ގޮތުގައި

3 ޖަނަބުލާ 1433

24 ޖުލައި 2012

މާލެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ނަންބަރު 03 1433 ގައި
ނަންބަރު 03 1433 ގައި
މާލެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ނަންބަރު 03 1433 ގައި

މަނިފަރާތްތަކުގެ ނަންބަރު: MHSC-IU/CSD/2012/20

މާލެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ނަންބަރު 03 1433 ގައި

މާލެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ނަންބަރު 03 1433 ގައި
މާލެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ނަންބަރު 03 1433 ގައި

މާލެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ނަންބަރު 03 1433 ގައި
މާލެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ނަންބަރު 03 1433 ގައި
މާލެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ނަންބަރު 03 1433 ގައި

މާލެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ނަންބަރު 03 1433 ގައި
މާލެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ނަންބަރު 03 1433 ގައި
މާލެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ނަންބަރު 03 1433 ގައި

Installation of Central Air-condition system or water chiller system in IGMH laboratory

Male health Services Corporation Limited invites interested parties to submit proposals for surveying & installation of Central Air- Condition System in IGMH Laboratory.

An information session will be held for the interested parties on 28th of May 2012 at 14:00 hours. Only interested parties who attend the information session will be given the opportunity to submit proposals.

The proposals must be submitted to the address below on 03rd June 2012 at 14:00hours.

Conference Hall/ IGMH Admin Block, 1st Floor
Male'Health Services Corporation Limited. (MHSC)
Kanbaa Aisa Rani Higun
Male', Maldives

For more information please contact 333 5349, or email: procurement @mhsc.com.mv

03 1433 1433
24 2012

މާލެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ނަންބަރު 03 1433 ގައި
މާލެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ނަންބަރު 03 1433 ގައި

މަނިފަރާތްތަކުގެ ނަންބަރު: JS-B /2012 /23

މާލެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ނަންބަރު 03 1433 ގައި

މާލެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ނަންބަރު 03 1433 ގައި

މާލެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ނަންބަރު 03 1433 ގައި
މާލެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ނަންބަރު 03 1433 ގައި

މާލެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ނަންބަރު 03 1433 ގައި
މާލެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ނަންބަރު 03 1433 ގައި
މާލެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ނަންބަރު 03 1433 ގައި

1 1433 1433
22 2012

މާލެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ލިޔުންތަކާއި ބެހޭ ވަޅުމެއް ހުރި ގޮތުގައި
 ނަންބަރު ގަޑިއަދުގެ ސަރުކާރުގެ ރިސޯސް،
 ގަޑި ނަންބަރު ގަޑިއަދު

ސަރުކާރުގެ ނަންބަރު: MHSC-IU/CSD/2012/21

ގަޑި ނަންބަރު

ގަޑި ނަންބަރު ގަޑިއަދުގެ ސަރުކާރުގެ ރިސޯސް

މާލެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ލިޔުންތަކާއި ބެހޭ ވަޅުމެއް ހުރި ގޮތުގައި
 ނަންބަރު ގަޑިއަދުގެ ސަރުކާރުގެ ރިސޯސް،
 ގަޑި ނަންބަރު ގަޑިއަދު

#	Qty	Description
1	10,000 Nos	X -RAY COVER (16.5” x 12.5”， 60gsm white paper, single colour print in blue ink)
2	10,000 Nos	X -RAY COVER (17.5” x 14.5”， 60gsm white paper, single colour print in blue ink)
3	10,000 Nos	X -RAY COVER (14.5” x 14.5”， 60gsm white paper, single colour print in blue ink)
4	10,000 Nos	X -RAY COVER (12.5” x 10.5”， 60gsm white paper, single colour print in blue ink)
5	5,000 Nos	X-RAY COVER – DENTAL (32 x 19cm ,60gsm white paper, single colour print in blue ink)

މާލެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ލިޔުންތަކާއި ބެހޭ ވަޅުމެއް ހުރި ގޮތުގައި
 ނަންބަރު ގަޑިއަދުގެ ސަރުކާރުގެ ރިސޯސް،
 ގަޑި ނަންބަރު ގަޑިއަދު
 2012 ވަނަ އަހަރު 05 ޖުލައި 28 ގައި 11:00 ގައި ގަޑި ނަންބަރު ގަޑިއަދުގެ ސަރުކާރުގެ ރިސޯސް
 2012 ވަނަ އަހަރު 05 ޖުލައި 30 ގައި 10:00 ގައި ގަޑި ނަންބަރު ގަޑިއަދުގެ ސަރުކާރުގެ ރިސޯސް
 3335349 ނަންބަރު ގަޑިއަދުގެ ސަރުކާރުގެ ރިސޯސް
 ގަޑި ނަންބަރު ގަޑިއަދު

Request for Quotations:

Male' Health Services Corporation Ltd request quotations from interested and eligible parties for print and supply of X-ray covers for the following specification:

#	Qty	Description
1	10,000 Nos	X -RAY COVER (16.5” x 12.5”， 60gsm white paper, single colour print in blue ink)
2	10,000 Nos	X -RAY COVER (17.5” x 14.5”， 60gsm white paper, single colour print in blue ink)
3	10,000 Nos	X -RAY COVER (14.5” x 14.5”， 60gsm white paper, single colour print in blue ink)
4	10,000 Nos	X -RAY COVER (12.5” x 10.5”， 60gsm white paper, single colour print in blue ink)
5	5,000 Nos	X-RAY COVER – DENTAL (32 x 19cm ,60gsm white paper, single colour print in blue ink)

An information session will be held at IGMH conference hall on 28th May 2012 at 1100hrs for the interested parties. Only the parties who attend the information session will be given the opportunity to submit the quotation.

The quotations must be submitted to the address below on 30th May 2012 at 1000hrs.

Conference Hall/ IGMH admin block, 1st floor
 Male' Health Service Corporation Ltd. (MHSC)
 Kanbaa Aisaarani Hingun
 Male', Maldives

For further Information please contact 333 5349 or email: procurement@mhsc.com.mv

03 ޖުލައި 2012 24 ޖުލައި 2012

State Electric Company Ltd.

Ref No: H-2012/68

Date: 24/05/2012

Request for Quotations

State Electric Company Limited (STELCO) requests sealed quotations from interested and eligible parties for the following item(s).

This request for Quotation is open for both local and international bidders.

Item	Description	Qty
1	Fabricate a sea water strainer using SS316	01 Nos.

• **Quotation shall indicate the following:**

- Price

* Door Step Delivery Price

OR

* CIF Male' Price

The following charges shall be applied for CIF Male' Prices:

1. for custom duty (25% of CIF price)
2. for clearing, handling & delivery to STELCO site (2% of the highest quoted CIF price)

* Quotation shall indicate the unit price, total price for each item and total price of the quotation.

- Currency (If not stated, shall be assumed as Maldivian Rufiyaa).

- Delivery period (In days). For CIF quoted quotations, additional 07 days shall be included for the clearing, handling and delivery to STELCO site. Delivery indicated as 'ex-stock' and a particular duration not specified shall be taken same as the party offering the longest delivery period.

- Technical specification(s): All the relevant information(s) shall be complete to enable technical evaluation of the item(s) quoted.

- Payment terms: 100% upon delivery within 30 working days. Payment shall be made in Maldivian rufiyaa

- Quotation validity: Quotation validity shall be minimum 30 days from the date of quotation opening.

- Company details: Shall submit company profile, registration copy and contact details.

- Important Note: It is in STELCO's discretion to reject/cancel any quotation which does not fulfil or comply the above terms, at anytime during the quotation evaluation process. Also it is in STELCO's discretion to cancel this request for quotation at anytime.

▪ **Quotation Evaluation Criteria:**

All Quotations shall be evaluated on the following basis. Points (pts) shall be given according to the formula below.

- Price = 80 pts [(Minimum Quoted Price) / (Quoted Price) x 80].
- Delivery period = 15 pts [(Shortest delivery period) / (Quoted delivery period) x 15].
- Experience = 05 pts (Shall submit reference letters for similar works done previously).

* Additional (US\$25.00 plus 4% of quotation amount shall be included to the price of quotation as financial costs for overseas payments).

• **The quotations shall be submitted in sealed envelope and addressed as follows:**

Head of Procurement Department
State Electric Company Limited.
(Fabricate a sea water strainer)
Ref. no: H-2012/68

- All sealed quotations shall reach STELCO head office on or before **Wednesday, 06th June 2012, 12:00hrs**. Any quotation(s) received after this deadline shall be disqualified.

- STELCO shall **not be liable** for the misplacement or premature opening for the unlabeled sealed quotations.

• **Pre-bid Meeting:**

A pre-bid meeting shall be held on **Tuesday, 29th May 2012, 12:00hrs, in STELCO Head Office / 2nd Floor meeting room**.

• **Quotation Opening:**

Quotation shall be opened on **Wednesday, 06th June 2012, 12:00hrs, in STELCO Head Office / 2nd Floor meeting room**, in the presence of those parties or their representatives who wish to attend the session.

▪ **Further information:**

Interested parties may obtain further information from the following address:

Procurement Department
State Electric Company Limited.
Ameenee Magu, Male', 20349
Republic of Maldives
Tel: (960) 333 8122
Fax: (960) 332 7036
E-mail: procurement@stelco.com.mv.

- This request for quotation is also published in STELCO website www.stelco.com.mv.

دعوتی وقت دس بجے آج کل
 دُعا، تہوار سراج

سرسہ: IL-BPMS/2012/36

انسٹریکشن کے ساتھ ساتھ

آج کل کے لئے ہر گزوری کے ساتھ ساتھ 4 بجے سے پہلے آج کل کے لئے ہر گزوری کے ساتھ ساتھ
 دیکھ کر آج کل کے لئے ہر گزوری کے ساتھ ساتھ 4 بجے سے پہلے آج کل کے لئے ہر گزوری کے ساتھ ساتھ
 انسٹریکشن کے ساتھ ساتھ

وقت	تہوار	تاریخ	موضوع
11:30	آج کل	29 آج کل 2012	دیکھ کر آج کل کے لئے ہر گزوری کے ساتھ ساتھ
14:30	آج کل	5 آج کل 2012	انسٹریکشن کے ساتھ ساتھ

1 بجے 1433
 22 آج کل 2012

دعوتی وقت دس بجے آج کل
 دُعا، تہوار سراج
 24 آج کل 2012

انسٹریکشن سرسہ: HRTD-MPL/2012/71

انسٹریکشن کے ساتھ ساتھ آج کل کے لئے ہر گزوری کے ساتھ ساتھ آج کل کے لئے ہر گزوری کے ساتھ ساتھ
 انسٹریکشن کے ساتھ ساتھ آج کل کے لئے ہر گزوری کے ساتھ ساتھ آج کل کے لئے ہر گزوری کے ساتھ ساتھ

انسٹریکشن کے ساتھ ساتھ آج کل کے لئے ہر گزوری کے ساتھ ساتھ آج کل کے لئے ہر گزوری کے ساتھ ساتھ
 آج کل کے لئے ہر گزوری کے ساتھ ساتھ آج کل کے لئے ہر گزوری کے ساتھ ساتھ آج کل کے لئے ہر گزوری کے ساتھ ساتھ
 آج کل کے لئے ہر گزوری کے ساتھ ساتھ آج کل کے لئے ہر گزوری کے ساتھ ساتھ آج کل کے لئے ہر گزوری کے ساتھ ساتھ
 آج کل کے لئے ہر گزوری کے ساتھ ساتھ آج کل کے لئے ہر گزوری کے ساتھ ساتھ آج کل کے لئے ہر گزوری کے ساتھ ساتھ

وقت	تہوار	تاریخ	موضوع
14:00	آج کل	29 آج کل 2012	دیکھ کر آج کل کے لئے ہر گزوری کے ساتھ ساتھ
14:00	آج کل	31 آج کل 2012	انسٹریکشن کے ساتھ ساتھ

دیکھ کر آج کل کے لئے ہر گزوری کے ساتھ ساتھ آج کل کے لئے ہر گزوری کے ساتھ ساتھ آج کل کے لئے ہر گزوری کے ساتھ ساتھ
 آج کل کے لئے ہر گزوری کے ساتھ ساتھ آج کل کے لئے ہر گزوری کے ساتھ ساتھ آج کل کے لئے ہر گزوری کے ساتھ ساتھ

آج کل کے لئے ہر گزوری کے ساتھ ساتھ

سرسہ: 3009272, 3009273, 3009274

سرسہ: 3321559

מראת הנהלת הוועדה
ד"ר, תרצה שניידר

מס' התעודות: 57-B/IU/2012/35

הודעה

הודעה על קיום ישיבה

מראת הנהלת הוועדה תערוך ישיבה
על שם "התאמת המערכת הכלכלית והחוקית"
ביום ראשון, 27 באוגוסט 2012, בשעה 11:00.
הישיבה תיערך בחדר 1433, בניין 22,
משרד המשפטים, ירושלים. מוזמנים להשתתף
בניגוד עם כל עניינים אחרים.
הודעה זו תישלח לרשימת המנויים.
3 באוגוסט 2012, שעה 14:00.
10 באוגוסט 2012, שעה 14:00.

1 מכתב 1433
22 באוגוסט 2012

ד"ר תרצה שניידר
מראת הנהלת הוועדה

מס' התעודות: (IUL)120/1/2012/38

הודעה

ד"ר תרצה שניידר תערוך ישיבה
ביום ראשון, 27 באוגוסט 2012, בשעה 11:00.

הישיבה תיערך בחדר 1433, בניין 22,
משרד המשפטים, ירושלים. מוזמנים להשתתף
בניגוד עם כל עניינים אחרים.
הודעה זו תישלח לרשימת המנויים.
3 באוגוסט 2012, שעה 14:00.

2 י 3 פוסט תערוך הודעה
על שם "התאמת המערכת הכלכלית והחוקית"
ביום ראשון, 27 באוגוסט 2012, בשעה 11:00.

1 מכתב 1433
22 באוגוסט 2012

ד"ר תרצה שניידר
מראת הנהלת הוועדה

מס' התעודות: (IUL)13-K/13/2012/38

מס' התעודות: TEB/2012/15

הודעה על קיום ישיבה

1. הודעה זו תערוך ישיבה
ביום ראשון, 27 באוגוסט 2012, בשעה 11:00.
הישיבה תיערך בחדר 1433, בניין 22,
משרד המשפטים, ירושלים. מוזמנים להשתתף
בניגוד עם כל עניינים אחרים.
הודעה זו תישלח לרשימת המנויים.
3 באוגוסט 2012, שעה 14:00.

2. ד"ר תרצה שניידר תערוך ישיבה
ביום ראשון, 27 באוגוסט 2012, בשעה 11:00.
הישיבה תיערך בחדר 1433, בניין 22,
משרד המשפטים, ירושלים. מוזמנים להשתתף
בניגוד עם כל עניינים אחרים.
הודעה זו תישלח לרשימת המנויים.
3 באוגוסט 2012, שעה 14:00.

3. ד"ר תרצה שניידר תערוך ישיבה
ביום ראשון, 27 באוגוסט 2012, בשעה 11:00.
הישיבה תיערך בחדר 1433, בניין 22,
משרד המשפטים, ירושלים. מוזמנים להשתתף
בניגוד עם כל עניינים אחרים.
הודעה זו תישלח לרשימת המנויים.
3 באוגוסט 2012, שעה 14:00.

23 באוגוסט 2012

ԿՆՏՐՈՆԻ ՎԵՐՆՈՒՄ ԿՈՒՐՍ

ԴԵՐՏՈՒՄ ԿՈՒՐՍԻ ԱՐԴԱՆՈՒՄ ԿՆՏՐՈՆԻ ՎԵՐՆՈՒՄ
ԴՊՄԻՆԻՍՏՐԱՏՐԱՏՈՐ

ՏՐՆՈՒՄ: (IUL) 28-FA-1/1/2012/21

ԴՊՐՈՒՄ

ԿՆՏՐՈՆԻ ՎԵՐՆՈՒՄ

ՌԴՄ. ԱՐԴԱՆՈՒՄ ԿՆՏՐՈՆԻՆԻ 02 ԱՐԴԱՆՈՒՄ ԿՆՏՐՈՆԻ ՎԵՐՆՈՒՄ 02 ԿՈՒՐՍԻ ՎԵՐՆՈՒՄ ԿՆՏՐՈՆԻ ՎԵՐՆՈՒՄ

ՉՈՒՄ, ԴԵՐՏՈՒՄ ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ 2012 ՎՐԱ 28 ՎՍՏՐ ԳՐՈՒՄ 14:00 ԱՐԴԱՆՈՒՄ ԿՆՏՐՈՒՄ
ՐԵՍՊԵԿՏԻՎ ԿՆՏՐՈՆԻՆԻ 2012 ՎՐԱ 31 ՎՍՏՐ ԳՐՈՒՄ 14:00 ԱՐԴԱՆՈՒՄ ԿՆՏՐՈՒՄ ԿՆՏՐՈՆԻՆԻ
ՐԵՍՊԵԿՏԻՎ ԿՆՏՐՈՆԻՆԻ 2012 ՎՐԱ 21 ՎՍՏՐ ԳՐՈՒՄ 14:00 ԱՐԴԱՆՈՒՄ ԿՆՏՐՈՒՄ ԿՆՏՐՈՆԻՆԻ
ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ

ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ 3313124 ԱՐԴԱՆՈՒՄ ԿՆՏՐՈՆԻՆԻ

30 ԿՆՏՐՈՆԻՆԻ 1433

21 ՎՐԱ 2012

ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ
ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ

ՏՐՆՈՒՄ: 7-ADHR/I/2012/24

ԴՊՐՈՒՄ

ԿՆՏՐՈՆԻ ՎԵՐՆՈՒՄ

ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ 7-ADHR/I/2012/1 (29 ԱՐԴԱՆՈՒՄ 2012) ԿՆՏՐՈՆԻՆԻ
ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ
ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ

1-4 ՎՍՏՐ ԿՆՏՐՈՆԻՆԻ

2-2 ՎՍՏՐ ԿՆՏՐՈՆԻՆԻ

ՉՈՒՄ, ԿՆՏՐՈՒՄ ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ 2012 ՎՐԱ 27 ԱՐԴԱՆՈՒՄ ԿՆՏՐՈՒՄ 14:00 ԱՐԴԱՆՈՒՄ
ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ 2012 ՎՐԱ 31 ԱՐԴԱՆՈՒՄ ԿՆՏՐՈՒՄ 14:00 ԱՐԴԱՆՈՒՄ ԿՆՏՐՈՒՄ
ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ ԿՆՏՐՈՆԻՆԻ

17 ՎՐԱ 2012

גריסינג פאר ארץ איז און
און, גריסינג פאר ארץ.

סרטינג: (IUL)23-AP/1/2012/126

אויבן

אונטערן 17טן יאנואר 2012 האט גריסינג פאר ארץ און גריסינג פאר ארץ 6 דעקלערירט אונטערן
אונטערן 17טן יאנואר 2012 האט גריסינג פאר ארץ און גריסינג פאר ארץ.

און, גריסינג פאר ארץ און גריסינג פאר ארץ 27טן יאנואר 2012 און גריסינג פאר ארץ 14:00 און גריסינג פאר ארץ
און גריסינג פאר ארץ (אונטערן 27טן יאנואר 2012 און גריסינג פאר ארץ 31טן יאנואר
און גריסינג פאר ארץ 10:00 און גריסינג פאר ארץ (אונטערן 27טן יאנואר 2012 און גריסינג פאר ארץ
און גריסינג פאר ארץ און גריסינג פאר ארץ.

און גריסינג פאר ארץ און גריסינג פאר ארץ און גריסינג פאר ארץ און גריסינג פאר ארץ
און גריסינג פאר ארץ און גריסינג פאר ארץ און גריסינג פאר ארץ און גריסינג פאר ארץ.

24 יאנואר 1433
15 יאנואר 2012

גריסינג פאר ארץ און גריסינג פאר ארץ
און, גריסינג פאר ארץ.

סרטינג: (IUL) 28-FA-1/1/2012/22

אויבן

אונטערן 22טן יאנואר 2012

און גריסינג פאר ארץ און גריסינג פאר ארץ און גריסינג פאר ארץ און גריסינג פאר ארץ
און גריסינג פאר ארץ און גריסינג פאר ארץ און גריסינג פאר ארץ און גריסינג פאר ארץ.

און, גריסינג פאר ארץ און גריסינג פאר ארץ 28טן יאנואר 2012 און גריסינג פאר ארץ 14:30 און גריסינג פאר ארץ
און גריסינג פאר ארץ און גריסינג פאר ארץ 31טן יאנואר 2012 און גריסינג פאר ארץ 14:30 און גריסינג פאר ארץ
און גריסינג פאר ארץ און גריסינג פאר ארץ און גריסינג פאר ארץ און גריסינג פאר ארץ און גריסינג פאר ארץ
און גריסינג פאר ארץ און גריסינג פאר ארץ און גריסינג פאר ארץ און גריסינג פאר ארץ.

און גריסינג פאר ארץ און גריסינג פאר ארץ און גריסינג פאר ארץ און גריסינג פאר ארץ 3313124 און גריסינג פאר ארץ.

30 יאנואר 1433
21 יאנואר 2012

سرسہ نمبر: (IUL)95-PM/1/2012/25

انسٹیسیوٹ کا سرسوارج

مجموعی اور درجہ دار اسی 2 قسٹ لایف ڈیویس سہ ماہی لائسنس کے ساتھ فوٹو کپی، پرنٹ اور اسکن 27 مارچ 2012ء کے
ڈسٹریکٹ 2:30 اور کلاس روم کے انسٹیسیوٹ کے ریزرو افسر کے ذریعے.

1 جس کو برقرار رکھنا ہے:

Item	Network photocopier machine (copy, print and scan)
Qty.	02
SPECIFICATION	
Device type	Printer / copier / scanner
Acceptable paper size	A5-A3
Copy, print, scan sizes	A5 –A3
Resolution	600dpi x 600dpi (colour scanning up to 300dpi x 300dpi)
Automatic document feeder	DADF
Copy/print/scan speed A4	30 CPM
Cassette universal	A5 – A3
Paper capacity	Up to 900 sheets total (trays 800+ Bypass 100 sheets)
Memory (RAM)	512 MB
Network Inter face	Ethernet (100Base-TX/10Base-T), USB 2.0
File format	JPEG, TIFF, PDF
Power supply	220V AC to 240V
OS support	Server 2008/Win7/Win XP/Win Vista
Warranty (Service and Parts)	Minimum 1 Year Parts, Minimum 1 Year Service

2- انسٹیسیوٹ کے ریزرو افسر کے ذریعے سہ ماہی لائسنس کے ساتھ فوٹو کپی اور پرنٹنگ:

- 1- جو افسر کے ریزرو افسر کے ذریعے فوٹو کپی اور پرنٹنگ کے ساتھ سہ ماہی لائسنس کے ساتھ برقرار رکھا جائے گا.
- 2- اس کے ساتھ ساتھ سہ ماہی لائسنس کے ساتھ فوٹو کپی اور پرنٹنگ کے ساتھ سہ ماہی لائسنس کے ساتھ برقرار رکھا جائے گا.
- 3- اس کے ساتھ ساتھ سہ ماہی لائسنس کے ساتھ فوٹو کپی اور پرنٹنگ کے ساتھ سہ ماہی لائسنس کے ساتھ برقرار رکھا جائے گا.
- 4- اس کے ساتھ ساتھ سہ ماہی لائسنس کے ساتھ فوٹو کپی اور پرنٹنگ کے ساتھ سہ ماہی لائسنس کے ساتھ برقرار رکھا جائے گا.

سرویس کارخانه ای در تعمیرگاه های تعمیراتی و مراکز خدمات مشتریان
 در صورتی که نیاز به خدمات فنی داشته باشید

سرویس شماره: 372-D/2012/23

درخواست

درخواست شماره 6666666666

و در صورتی که نیاز به خدمات فنی داشته باشید، لطفاً به شماره تلفن 6666666666 یا به آدرس ایمیل fmagoodhoo@gmail.com تماس بگیرید.
 در صورتی که نیاز به خدمات فنی داشته باشید، لطفاً به شماره تلفن 6666666666 یا به آدرس ایمیل fmagoodhoo@gmail.com تماس بگیرید.

در تاریخ 14 آبان 2012 و ساعت 14:00 در محل کارخانه تعمیرات و نگهداری خودروهای سواری و موتورسیکلتی، درخواستی برای تعمیر موتور یک خودروی سواری مدل TD 720GE VOLVO PENTA, 112KW دریافت شد. این خودرو در حال حاضر در تعمیرگاه شماره 6666666666 قرار دارد. این درخواست شامل موارد زیر است:

Quantity	Part Number	Description
7	21141948	MAIN BEARIN KIT
1	21141955	THUST WASHER
6	11700316-0	BIG END BEARING KIT
12	11700326-9	SCREW
6	20714469-2	INLET VALVE
6	20565912-1	EXHAUST VALVE
24	11700345-9	VALVE COLLET
12	20405897-8	VALVE GUIDE
6	20459962-5	VALVE SEAT
6	20459963-3	VALVE SEAT
6	21304975-2	PISTON RING
1	21486084	SEALING RING
1	21486081	SEALING RING
1	3831236-9	OIL FILTER
1	20405915-8	GASKET
1	21492771	FUEL FILTER
1	978750-8	V-BELT
6	20508553-3	NOZZLE
1	3840034-7	FILTER INSERT
1	20592177-8	V- BELT
1	20412597-5	GASKET
1	20405900-0	GASKET

23 شهریور 2012

ارادته بررجه تادسوس اتره تر دوعه وسته
دعا، برقراره ارج

سرهه نم: (IUL) 168-CA/1/2012/17

اداره

ارسترسرهه هادسوس ارج

دعاه سوسره 12 ارج ارج ارج و ارج ارج
ترهه ارج ارج ارج ارج ارج

دعاه، ارج ارج ارج ارج ارج ارج
ارج ارج ارج ارج ارج ارج 27 و ارج ارج
ارج ارج ارج ارج ارج ارج 10:30 ارج ارج ارج
ارج ارج ارج ارج ارج ارج 29 و ارج ارج
ارج ارج ارج ارج ارج ارج 10:30 ارج ارج ارج
ارسترسرهه ارج ارج ارج ارج ارج
ارج ارج ارج ارج ارج ارج ارج ارج ارج
ارج ارج ارج ارج ارج ارج ارج ارج ارج

25 ارج ارج ارج 1433
16 ارج 2012

دسرهه ارج ارج ارج
دعا، برقراره ارج

سرهه نم: (IUL)23-AP/1/2012/131

اداره

ارسترسرهه ارج ارج ارج ارج ارج ارج
ارج ارج ارج ارج ارج ارج ارج

دعاه، ارج ارج ارج ارج ارج ارج
ارج ارج ارج ارج ارج ارج 11:00 ارج ارج ارج
ارج ارج ارج ارج ارج ارج ارج ارج ارج ارج
ارج ارج ارج ارج ارج ارج ارج 07 و ارج
ارج ارج ارج ارج ارج ارج 10:00 ارج ارج ارج
ارج ارج ارج ارج ارج ارج ارج ارج ارج
ارسترسرهه ارج ارج ارج ارج ارج

ارج ارج ارج ارج ارج ارج ارج ارج
ارج ارج ارج ارج ارج ارج ارج ارج ارج
ارج ارج ارج ارج ارج ارج ارج ارج ارج
ارج ارج ارج ارج ارج ارج ارج ارج ارج
ارج ارج ارج ارج ارج ارج ارج ارج ارج

26 ارج ارج ارج 1433
17 ارج 2012

دعاه وسته ارج ارج
برقراره ارج

سرهه نم: (IUL)14-A3/1/2012/18

اداره

ارج ارج ارج ارج ارج ارج ارج ارج

دعاه، ارج ارج ارج ارج ارج ارج
ارج ارج ارج ارج ارج ارج ارج ارج ارج
ارج ارج ارج ارج ارج ارج ارج 11:00
ارج ارج ارج ارج ارج ارج ارج ارج ارج
ارج ارج ارج ارج ارج ارج ارج ارج ارج
ارج ارج ارج ارج ارج ارج ارج ارج ارج

26 ارج ارج ارج 1433
17 ارج 2012

2012 10:00 14:00
 6820012 , 6820010
 6820013

- 6820012 , 6820010
- 6820013
- info@kooddoo.com.mv

KFM-AD/2012/42

අනුමැතිය

කොටස් කැණීමේ කොමිෂන් කමිටුවේ සාමාජිකයන්ගේ සහ
 අධ්‍යක්ෂවරයාගේ සහ අනුමැතිය ලබාදීමේ කොමිෂන් කමිටුවේ සාමාජිකයන්ගේ
 සහ අධ්‍යක්ෂවරයාගේ සහ අනුමැතිය ලබාදීමේ කොමිෂන් කමිටුවේ සාමාජිකයන්ගේ

CONDENSER PUMP:

PUMP WITH MOTOR

BRAND: GRUNDFOSS
 TYPE: NB 80-160/153C-F-B-BAQE
 CAPACITY: 168CUB.M/HR
 HEAD: 22.2M
 RPM: 2930

2012 ජූනි 31 දා 10:00 ට පසුව
 2012 ජූනි 27 දා 10:00 ට පසුව
 2012 ජූනි 25 දා 14:00 ට පසුව
 2012 ජූනි 16 දා 14:00 ට පසුව

1433 25
 2012 16

2012 10:00 14:00
 6820012 , 6820010
 6820013

(IUL) 223/1/2012/7

අනුමැතිය

අනුමැතිය ලබාදීමේ කොමිෂන් කමිටුවේ

සාමාජිකයන්ගේ සහ අධ්‍යක්ෂවරයාගේ සහ අනුමැතිය ලබාදීමේ කොමිෂන් කමිටුවේ සාමාජිකයන්ගේ සහ අධ්‍යක්ෂවරයාගේ සහ අනුමැතිය ලබාදීමේ කොමිෂන් කමිටුවේ සාමාජිකයන්ගේ

අංකය	නම
2	CorelDraw Graphics Suite X6
2	Adobe Acrobat X Pro

අනුමැතිය ලබාදීමේ කොමිෂන් කමිටුවේ

70%	■ අධ්‍යක්ෂවරයා
15%	■ සාමාජිකයන්
15%	■ සාමාජිකයන්

2012 ජූනි 27 දා 10:00 ට පසුව
 2012 ජූනි 25 දා 14:00 ට පසුව
 2012 ජූනි 16 දා 14:00 ට පසුව

1433 30
 2012 21

2012 10:00 14:00
 6820012 , 6820010
 6820013

(IUL)32-A/1/2012/10

අනුමැතිය

අනුමැතිය ලබාදීමේ කොමිෂන් කමිටුවේ සාමාජිකයන්ගේ සහ අධ්‍යක්ෂවරයාගේ සහ අනුමැතිය ලබාදීමේ කොමිෂන් කමිටුවේ සාමාජිකයන්ගේ සහ අධ්‍යක්ෂවරයාගේ සහ අනුමැතිය ලබාදීමේ කොමිෂන් කමිටුවේ සාමාජිකයන්ගේ

2012 ජූනි 3 දා 14:00 ට පසුව
 2012 ජූනි 24 දා 14:00 ට පසුව

1433 03
 2012 24

דו"ר פרופ' רחל שוחן
התפקידים והמחויבויות לראש המוסד

מס' הפרוטוקול: MBC-F/IU/2012/39

האגודה

במהלך הדיווח האחרון, הציגה האגודה נתונים על פעילותה ופיתוחה במהלך השנה, והציגה תוכנית פעולה לראש השנה הבאה. הדיווח נערך בשיתוף פעולה עם משרד החינוך והנוער, ומטרתו היא להעריך את האגודה ולתמוך בה בפעילותה. הדיווח יוצג בדיווח מוסדית מס' MBC-F/IU/2012/39.

ב-27 באפריל 2012, בשעה 11:00, התקיים הדיווח לראש המוסד, שבו הציגה האגודה את הדיווח שלה. הדיווח נערך בהשתתפות משרד החינוך והנוער, ומטרתו היא להעריך את האגודה ולתמוך בה בפעילותה. הדיווח יוצג בדיווח מוסדית מס' MBC-F/IU/2012/39.

29 אפריל 1433

20 באפריל 2012

דיווח ראש המוסד
התפקידים והמחויבויות לראש המוסד

מס' הפרוטוקול: (IUL)23-AP/1/2012/117

האגודה

במהלך הדיווח האחרון, הציגה האגודה נתונים על פעילותה ופיתוחה במהלך השנה, והציגה תוכנית פעולה לראש השנה הבאה. הדיווח נערך בשיתוף פעולה עם משרד החינוך והנוער, ומטרתו היא להעריך את האגודה ולתמוך בה בפעילותה. הדיווח יוצג בדיווח מוסדית מס' (IUL)23-AP/1/2012/117.

ב-27 באפריל 2012, בשעה 11:00, התקיים הדיווח לראש המוסד, שבו הציגה האגודה את הדיווח שלה. הדיווח נערך בהשתתפות משרד החינוך והנוער, ומטרתו היא להעריך את האגודה ולתמוך בה בפעילותה. הדיווח יוצג בדיווח מוסדית מס' (IUL)23-AP/1/2012/117.

ב-26 באפריל 2012, בשעה 13:00, התקיים הדיווח לראש המוסד, שבו הציגה האגודה את הדיווח שלה. הדיווח נערך בהשתתפות משרד החינוך והנוער, ומטרתו היא להעריך את האגודה ולתמוך בה בפעילותה. הדיווח יוצג בדיווח מוסדית מס' (IUL)23-AP/1/2012/117.

26 אפריל 1433

17 באפריל 2012

دعوت و نه اړوندو سره مخامخېدونکې
دغه، ترڅو راجع

نومبر: (IUL)220-AF/01/2012/59

د اړوندو

اړوندو سره مخامخېدونکې

د اړوندو سره مخامخېدونکې ترڅو راجع
ترڅو راجع، چې د اړوندو سره مخامخېدونکې
د اړوندو سره مخامخېدونکې ترڅو راجع.

- 08 ترڅو راجع (د اړوندو سره مخامخېدونکې)
- 12 ترڅو راجع
- 12 ترڅو راجع
- 08 ترڅو راجع
- 08 ترڅو راجع
- 12 راجع
- 04 ترڅو راجع
- 04 ترڅو راجع
- 04 ترڅو راجع
- 02 ترڅو راجع
- 02 ترڅو راجع

دغه، چې د اړوندو سره مخامخېدونکې
30 څو راجع 2012 و چې ترڅو راجع 15:00 اړوند
په اړوندو سره مخامخېدونکې ترڅو راجع.

اړوندو سره مخامخېدونکې ترڅو راجع
3339521 اړوندو سره مخامخېدونکې.

03 مخامخېدونکې 1433
24 څو راجع 2012

د اړوندو سره مخامخېدونکې ترڅو راجع
سره، چې ترڅو راجع.

نومبر: 290/2012/13

د اړوندو

اړوندو سره مخامخېدونکې

د اړوندو سره مخامخېدونکې ترڅو راجع
د اړوندو سره مخامخېدونکې ترڅو راجع.

• 6sqm د اړوندو سره مخامخېدونکې 600 څو راجع (2)

دغه، چې د اړوندو سره مخامخېدونکې
2012 څو راجع 31 و چې ترڅو راجع 15:00 اړوند
د اړوندو سره مخامخېدونکې ترڅو راجع.
د اړوندو سره مخامخېدونکې ترڅو راجع 09:00 اړوند
15:00 اړوند چې ترڅو راجع نومبر 6560005 ترڅو راجع
د اړوندو سره مخامخېدونکې.

د اړوندو سره مخامخېدونکې ترڅو راجع
د اړوندو سره مخامخېدونکې ترڅو راجع.

01 مخامخېدونکې 1433
22 څو راجع 2012

د اړوندو سره مخامخېدونکې ترڅو راجع
سره، چې ترڅو راجع.

نومبر: (IUL)A-2012/10

د اړوندو

اړوندو سره مخامخېدونکې

د اړوندو سره مخامخېدونکې ترڅو راجع
د اړوندو سره مخامخېدونکې ترڅو راجع.

01 ترڅو راجع (سره، چې ترڅو راجع) 6.5 راجع

دغه، چې د اړوندو سره مخامخېدونکې
30 څو راجع 2012 و چې ترڅو راجع 11:30 اړوند
و چې ترڅو راجع 06 څو راجع 2012 و چې ترڅو راجع
11:30 اړوند چې ترڅو راجع اړوندو سره مخامخېدونکې
د اړوندو سره مخامخېدونکې.

01 مخامخېدونکې 1433
22 څو راجع 2012

Տեղի ունեցող ընդհանուր հարցաթուղթը ստորագրողները կ'ընդունեն
 Եր. հարցաթուղթի կրթական բաժնի

Տրամադրված: 420/2012/20

Վարչություն

Հարգելի զեքստերնացիներ, խնդրում ենք ձեռնարկել հարցաթուղթի մասին
 համարյա չհարմար ընդհանուր հարցաթուղթը: Չհարմար ընդհանուր հարցաթուղթը
 ստորագրողները զեքստերնացիները 28 ժամ 2012 թվականի օրը ընդհանուր հարցաթուղթը
 ընդհանուր հարցաթուղթը 2:00 և Նախքան ընդհանուր հարցաթուղթը ընդհանուր հարցաթուղթը:
 ընդհանուր հարցաթուղթը և ընդհանուր հարցաթուղթը:

- 05 Խճապիչի 120 ընդհանուր հարցաթուղթը
- 05 Խճապիչի 200 ընդհանուր հարցաթուղթը
- 24 Կրթության զեքստերնացիները 2 ընդհանուր հարցաթուղթը
- 24 Նախնական հարցաթուղթը
- 10 Գերազանցիչ և արժանացիչ ընդհանուր հարցաթուղթը
- 20 Մեծ ընդհանուր հարցաթուղթը A4 ընդհանուր հարցաթուղթը 80 և ընդհանուր հարցաթուղթը
- 24 Գերազանցիչ և արժանացիչ ընդհանուր հարցաթուղթը 40 ML և ընդհանուր հարցաթուղթը
- 10 Նախնական հարցաթուղթը
- 04 Նախնական հարցաթուղթը 21 HP և ընդհանուր հարցաթուղթը
- 02 Նախնական հարցաթուղթը 21 HP (TN2130) և ընդհանուր հարցաթուղթը
- 02 Նախնական հարցաթուղթը 15 A և ընդհանուր հարցաթուղթը
- 02 Ընդհանուր հարցաթուղթը
- 12 Գերազանցիչ ընդհանուր հարցաթուղթը 10 ընդհանուր հարցաթուղթը
- 01 Նախնական հարցաթուղթը 12 և ընդհանուր հարցաթուղթը

20 ժամ 2012

Ստորագրողները ընդհանուր հարցաթուղթի
 ժամ և ընդհանուր հարցաթուղթի

Տրամադրված: IUL-123(A)2012/15

Վարչություն

Ընդհանուր հարցաթուղթի ընդհանուր հարցաթուղթը:

Չհարմար ընդհանուր հարցաթուղթը IUL-123(A)2012/12
 (30 ընդհանուր հարցաթուղթը 2012) և ընդհանուր հարցաթուղթը ընդհանուր հարցաթուղթը
 և ընդհանուր հարցաթուղթը ընդհանուր հարցաթուղթը, և ընդհանուր հարցաթուղթը ընդհանուր հարցաթուղթը
 ընդհանուր հարցաթուղթը:

Ընդհանուր հարցաթուղթը	Ընդհանուր հարցաթուղթը
04	Խճապիչի 120 ընդհանուր հարցաթուղթը
01	Խճապիչի 2 ընդհանուր հարցաթուղթը 2 ընդհանուր հարցաթուղթը
03	Խճապիչի 2 ընդհանուր հարցաթուղթը 2 ընդհանուր հարցաթուղթը
01	Խճապիչի 3 ընդհանուր հարցաթուղթը
	Mbps 24XRJ45/10/100/1000
01	Գերազանցիչ և արժանացիչ ընդհանուր հարցաթուղթը

Չհարմար ընդհանուր հարցաթուղթը ընդհանուր հարցաթուղթը
 ընդհանուր հարցաթուղթը 31 ժամ 2012 թվականի օրը ընդհանուր հարցաթուղթը
 ընդհանուր հարցաթուղթը 10:00 ժամը ընդհանուր հարցաթուղթը և ընդհանուր հարցաթուղթը
 ընդհանուր հարցաթուղթը 07 ընդհանուր հարցաթուղթը 2012 թվականի օրը ընդհանուր հարցաթուղթը
 ընդհանուր հարցաթուղթը 10:00 ժամը ընդհանուր հարցաթուղթը ընդհանուր հարցաթուղթը
 ընդհանուր հարցաթուղթը ընդհանուր հարցաթուղթը և ընդհանուր հարցաթուղթը
 ընդհանուր հարցաթուղթը ընդհանուր հարցաթուղթը ընդհանուր հարցաթուղթը և ընդհանուր հարցաթուղթը
 և ընդհանուր հարցաթուղթը:

03 ընդհանուր հարցաթուղթը 1433

24 ժամ 2012

سہولت بخشہ ہو، جس سے
 قریب تر ہو، جس سے

سہولت بخشہ ہو: CUL/IUL/2012/20

دوسرا

دوسرا (CUMMINS) سہولت بخشہ ہو، جس سے قریب تر ہو، جس سے
 سہولت بخشہ ہو، جس سے

DETAILS OF GENERATOR:

Engine Model: CUMMINS
 Engine Model No: 6CTAA 8.3G
 Engine Serial No: 21782155
 CPL No: 2664

DH.MEEDHOO POWER HOUSE

#	QTY	UNIT	DESCRIPTION
1	01	NOS	BELT, V RIBBED
2	01	NOS	SCREW,CAPTIVE WASHER CAP
3	07	NOS	BUSHING CAMSHAFT
4	01	NOS	CAMSHAFT
5	01	NOS	CAPFILLER
6	01	NOS	SCREW, BANJO CONNECTOR
7	12	NOS	BEARING,CON ROD (STD)
8	12	NOS	BOLT, CONNECTING ROD
9	01	NOS	PUMP, FUEL TRANSFER
10	01	SET	GASKET, OIL DRAIN
11	12	NOS	GUIDE, VALVE STEM
12	01	NOS	HOSE PLAIN
13	01	NOS	HOSE PLAIN
14	01	NOS	HOSE PLAIN
15	02	NOS	HOSE PLAIN
16	04	NOS	HOSE PLAIN
17	06	NOS	NOZZLE INJECTOR
18	06	NOS	KIT ENGINE PISTON
19	06	NOS	KIT LINER
20	01	NOS	PUMP,WATER
21	12	NOS	NUT, REGULAR HEXAGON
22	06	NOS	PIN PISTON
23	01	NOS	PLUG, EXPANSION
24	12	NOS	COLLET VALVE
25	12	NOS	SPRING, VALVE EXHAST
26	01	NOS	SUPPORT, CAMSHAFT
27	01	SET	SET LOWER ENGINE GASKET

شماره: (IUL)220-AF/01/2012/60

موضوع

کارگاه آموزشی برای مدیران و کارکنان سازمانها و مراکز دولتی و خصوصی در تاریخ 02 شهریور 1391 برگزار خواهد شد.
(IUL)220-AF/1/2012/37
ساعت 11:00 روز 05 شهریور 1391 و ساعت 11:00 روز 06 شهریور 1391 برگزار خواهد شد.
کارگاه آموزشی (تئوری و عملی) و به زبان فارسی برگزار خواهد شد.

No.	Name	Author	ISBN
1	Educational Psychology	Anita Woolfolk Hoy, Anita Woolfolk	137144547
2	Powerful Presentation Skills	Dennis Becker, Paula Borkum Becker	1556238703
3	How to Run Seminars and Workshops	Robert L. Jolles	471715875
4	How to Conduct Surveys	Arlene Fink, Jacqueline Kosecoff	141291423X
5	Analysis of Survey Data	Ray Chambers	0 471 89987 9
6	The Art of Public Speaking 10th Edition	Stephen Lucas	73385158
7	Call Center Technology Demystified No-Nonsense Guide	Lori Bocklund and Dave Bengston	970950780
8	Preparing the Marketing Plan	David Parmerlee	658001345
9	The Economics of Taxation 2nd Edition	Bernard Selanie	ISBN-10: 0-262-01634-6 ISBN-13: 978-0-262-01634-6
10	Introduction to the Law of Double Tax Conventions	Michael Lang	978-90-8722-082-2
11	The Modern VAT	IMF	978-1-58906-026-5
12	Essentials: An Internal Audit Operations Manual	Archie R. Thomas, CIA, CMA, FCMA, CFE	978-0-89413-616-0

ملاحظات

- 80% (مشارکتی) از هزینه‌های کارگاه بر عهده شرکت است.
- 20% (مشارکتی) از هزینه‌های کارگاه بر عهده سازمان است.

ملاحظات تکمیلی

- شماره کتابها و نویسندگان در کتابچه کارگاه درج شده است.
- هزینه‌های اسکان و تغذیه در کارگاه بر عهده شرکت است.
- هزینه‌های اسکان و تغذیه در کارگاه 0.75% (سه‌دوازدهم) از هزینه‌های کارگاه است.
- هزینه‌های اسکان و تغذیه در کارگاه 15% از هزینه‌های کارگاه است.

1. 2012 22 1433 1
 2012 22

KACL/iulaan/2012/010

1. 2012 22 1433 1
 2012 22

KACL/iulaan/2012/006
 15:00 2012 31
 6800704

#	Qty:	Description:	Part No:
Engine Model: 4T112TLE (Yanmar Diesel Generator)			
1	6	Nos. Oil filter	123672-35151
2	6	Nos. Oil filter	127695-35150
3	10	Nos. Fuel filter	120324-55760
4	2	Nos. Air filter (in)	121922-121510
5	2	Nos. Air filter (out)	121922-121510
6	2	Nos. Oil seal	123672-01782
7	2	Nos. Oil seal	127692-01781
8	2	Nos. Seal, oil	123500-01900
9	1	No. V belt	124610-77351
10	1	No. Pipe rubber	121952-39600

1433 1

2012 22

1. 2012 22 1433 1
 2012 22

KACL/iulaan/2012/011

1. 2012 22 1433 1
 2012 22

KACL/iulaan/2012/07

Ministry of Finance and Treasury

Male', Republic of Maldives

Ref.No: (IUL)13-K/13/2012/52

Project Number: TEB/2012/14

INVITATION FOR BIDS

Subject: Supply, Delivery and Installation of Equipment, Furniture and Internet Services for Community e-Centre Project-Phase I- funded by the SAARC Development Fund (SDF)

1. The Ministry of Finance and Treasury, on behalf of National Centre for Information Technology, (the Employer), invites sealed bids from eligible and qualified local and foreign bidders for the Supply and Delivery of Furniture, Equipment and Internet Service for the following three bid lots;

Details	Bid Security	Pre-Bid	Bid-Opening
Furniture (LOT-1)	MRF 15,000.00	4th June 2012 (1000hrs)	14th June 2012 (1000hrs)
Equipment (LOT-2)	MRF 70,000.00	4th June 2012 (1030hrs)	14th June 2012 (1100hrs)
Internet Service (LOT-3)	MRF 50,000.00	4th June 2012 (1100hrs)	14th June 2012 (1200hrs)

2. A complete set of Tender Documents may be obtained from **28th May 2012 to 7th June 2012** Tender Evaluation Section of Ministry of Finance and Treasury **0830** hrs and **1430** hrs on all working days, upon payment of a non-refundable fee of MRF **500** (Five Hundred Rufiyaa Only) per document.

3. Bidders may obtain further information from the following address,

Tender Evaluation Section
Ministry of Finance and Treasury,
Ameenee Magu,
Malé, Maldives,
Tel: (960) 3349296, (960) 3349106
Fax: (960) 3320706, (960) 3324432
E-Mail: tender@finance.gov.mv

4. Bid security shall be valid for a period of 118 days from the date of bid opening shall be delivered to the Ministry of Finance and Treasury at the address specified above in Clause 3 of this Invitation for Bids.

5. This Invitation for Bid is also published in the Ministry of Finance and Treasury website www.finance.gov.mv.

နံပါတ်: (IUL)13-K/13/2012/52

နံပါတ်: TEB/14/1220

အဖွဲ့အစည်းနှင့် အဖွဲ့အစည်း

1. အဖွဲ့အစည်းကို အဖွဲ့အစည်းနှင့် အဖွဲ့အစည်း (အဖွဲ့အစည်းနှင့် အဖွဲ့အစည်း) ကို အဖွဲ့အစည်း
အဖွဲ့အစည်းနှင့် အဖွဲ့အစည်းကို အဖွဲ့အစည်းနှင့် အဖွဲ့အစည်း ဖြစ်ပေါ်စေမည်။
အဖွဲ့အစည်းနှင့် အဖွဲ့အစည်းကို အဖွဲ့အစည်းနှင့် အဖွဲ့အစည်း ဖြစ်ပေါ်စေမည်။

အဖွဲ့အစည်း	အဖွဲ့အစည်း	အဖွဲ့အစည်း	အဖွဲ့အစည်း
14 နံပါတ် (10:00)	4 နံပါတ် (10:00)	-/15,000 နံပါတ်	အဖွဲ့အစည်း (1)
14 နံပါတ် (11:00)	4 နံပါတ် (10:30)	-/70,000 နံပါတ်	အဖွဲ့အစည်း (2)
14 နံပါတ် (12:00)	4 နံပါတ် (11:00)	-/50,000 နံပါတ်	အဖွဲ့အစည်း (3)

2. အဖွဲ့အစည်းနှင့် အဖွဲ့အစည်း 118 နံပါတ် အဖွဲ့အစည်းနှင့် အဖွဲ့အစည်း
အဖွဲ့အစည်းနှင့် အဖွဲ့အစည်း 5% အဖွဲ့အစည်းနှင့် အဖွဲ့အစည်း 15% အဖွဲ့အစည်း
အဖွဲ့အစည်းနှင့် အဖွဲ့အစည်း ဖြစ်ပေါ်စေမည်။

3. အဖွဲ့အစည်းနှင့် အဖွဲ့အစည်း 28 နံပါတ် 7 နံပါတ် 2012 ခုနှစ်၊
08:30 နံပါတ် 14:30 အဖွဲ့အစည်းနှင့် အဖွဲ့အစည်း 500/- (အဖွဲ့အစည်း) နံပါတ် အဖွဲ့အစည်း
အဖွဲ့အစည်းနှင့် အဖွဲ့အစည်း ဖြစ်ပေါ်စေမည်။

4. အဖွဲ့အစည်းနှင့် အဖွဲ့အစည်း အဖွဲ့အစည်းနှင့် အဖွဲ့အစည်း အဖွဲ့အစည်းနှင့် အဖွဲ့အစည်း
အဖွဲ့အစည်းနှင့် အဖွဲ့အစည်း ဖြစ်ပေါ်စေမည်။

دۇرۇم سۈرۈشۈپ كەتكەن لايىھىلەش ۋە
 لاسىڭا ئارىسىمىز رىس،
 دۇرۇم تېزلىتىش

سۈرۈشۈپ: MHSC-IU/CSD/2012/22

تەلپىم

رەسپوندىسىڭىزنىڭ كۈتىۋاتىمىز.

بۇ تەلپىم ئۈچۈن كۈتىۋاتىمىز سۈرۈشۈپ كەتكەن لايىھىلەش ۋە
 سۈرۈشۈپ كەتكەن لايىھىلەش ۋە تېزلىتىش كۈتىۋاتىمىز.

#	Item Description	Qty
01	BSP Bull Nose Fitting Tailpipe, Oxygen MCS2 1828126-5/8"	24 Pcs
02	Non Return Valve Cap Kit, Oxygen, MCS2	24 Pcs

• تەلپىم ئۈچۈن:

- 1- بۇ تەلپىم ئۈچۈن كۈتىۋاتىمىز سۈرۈشۈپ كەتكەن لايىھىلەش ۋە
- 2- كۈتىۋاتىمىز سۈرۈشۈپ كەتكەن لايىھىلەش ۋە
- 3- لايىھىلەش ۋە (تەلپىم 30 تۈرۈم سۈرۈشۈپ كەتكەن)
- 4- تەلپىم ئۈچۈن كۈتىۋاتىمىز سۈرۈشۈپ كەتكەن لايىھىلەش ۋە، كۈتىۋاتىمىز سۈرۈشۈپ كەتكەن لايىھىلەش ۋە تېزلىتىش كۈتىۋاتىمىز
- 5- كۈتىۋاتىمىز سۈرۈشۈپ كەتكەن لايىھىلەش ۋە تېزلىتىش كۈتىۋاتىمىز

• كۈتىۋاتىمىز سۈرۈشۈپ كەتكەن لايىھىلەش ۋە تېزلىتىش كۈتىۋاتىمىز

- 1- تەلپىم (تەلپىم ئۈچۈن) 50 تۈرۈم
- 2- تەلپىم: 30 تۈرۈم
- 3- تەلپىم: 10 تۈرۈم (كۈتىۋاتىمىز سۈرۈشۈپ كەتكەن لايىھىلەش ۋە تېزلىتىش كۈتىۋاتىمىز)
- 4- تەلپىم: 10 تۈرۈم

• كۈتىۋاتىمىز سۈرۈشۈپ كەتكەن لايىھىلەش ۋە تېزلىتىش كۈتىۋاتىمىز

- لايىھىلەش ۋە تېزلىتىش كۈتىۋاتىمىز
- كۈتىۋاتىمىز سۈرۈشۈپ كەتكەن لايىھىلەش ۋە تېزلىتىش كۈتىۋاتىمىز

بۇ تەلپىم ئۈچۈن كۈتىۋاتىمىز سۈرۈشۈپ كەتكەن لايىھىلەش ۋە تېزلىتىش كۈتىۋاتىمىز 31 ئاينىڭ 14:00 تا
 بۇ تەلپىم ئۈچۈن كۈتىۋاتىمىز سۈرۈشۈپ كەتكەن لايىھىلەش ۋە تېزلىتىش كۈتىۋاتىمىز.

- تەلپىم: كۈتىۋاتىمىز سۈرۈشۈپ كەتكەن لايىھىلەش ۋە تېزلىتىش كۈتىۋاتىمىز
- كۈتىۋاتىمىز سۈرۈشۈپ كەتكەن لايىھىلەش ۋە تېزلىتىش كۈتىۋاتىمىز 3335297، 3335349 سۈرۈشۈپ كەتكەن لايىھىلەش ۋە تېزلىتىش كۈتىۋاتىمىز.

03 تەلپىم 1433

24 ئاينىڭ 2012

لار ائزى كرسىسى

دۇئا ۋە ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ
دۇئا، تەسۋىھىتى

سۈرەت نومۇرى: MTCC-PD/IU/2012/94

دۇئا

دۇئا ۋە ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ
دۇئا، تەسۋىھىتى

دۇئا ۋە ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ
دۇئا، تەسۋىھىتى

دۇئا ۋە ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ
دۇئا، تەسۋىھىتى

01 نەپەس 1433
24 خۇن 2012

دۇئا ۋە ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ
دۇئا، تەسۋىھىتى

سۈرەت نومۇرى: MECL 34/2010

دۇئا

دۇئا ۋە ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ

دۇئا ۋە ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ
دۇئا، تەسۋىھىتى

دۇئا ۋە ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ
دۇئا، تەسۋىھىتى

دۇئا ۋە ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ
دۇئا، تەسۋىھىتى

سۈرەت نومۇرى: (IUL) 425-CB/1/2012/98

دۇئا

دۇئا ۋە ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ
دۇئا، تەسۋىھىتى

دۇئا ۋە ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ
دۇئا، تەسۋىھىتى

دۇئا ۋە ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ
دۇئا، تەسۋىھىتى

دۇئا ۋە ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ
دۇئا، تەسۋىھىتى

30 نەپەس 1433
21 خۇن 2012

دۇئا ۋە ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ ئىسپات نامىزىنىڭ
دۇئا، تەسۋىھىتى

21 خۇن 2012

د واده د تړن په اړه د پاملرنې د تړن د تړن

د تړن د سرته: رېښه سونو د واده د تړن د سرته: د تړن د سرته

4465/- :سرته رېښه سونو د واده د تړن د سرته: 1500/-

01 (رېښه سونو) : د واده د تړن د سرته رېښه سونو د واده د تړن د سرته

د واده د تړن د سرته رېښه سونو د واده د تړن د سرته: 3

رېښه سونو د واده د تړن د سرته: رېښه سونو د واده د تړن د سرته 1

د تړن د سرته	د تړن د سرته
1. سونو د واده د تړن د سرته 2 د واده د تړن د سرته 'د' د واده د تړن د سرته، سونو د واده د تړن د سرته رېښه سونو د واده د تړن د سرته 'د' د واده د تړن د سرته، سونو د واده د تړن د سرته 2. د واده د تړن د سرته د واده د تړن د سرته د واده د تړن د سرته د واده د تړن د سرته 2 د واده د تړن د سرته رېښه سونو د واده د تړن د سرته د واده د تړن د سرته د واده د تړن د سرته 6 اړخه تړن د سرته د واده د تړن د سرته د واده د تړن د سرته، سونو د واده د تړن د سرته 3. د واده د تړن د سرته د واده د تړن د سرته د واده د تړن د سرته د واده د تړن د سرته 3 د واده د تړن د سرته د واده د تړن د سرته د واده د تړن د سرته، سونو د واده د تړن د سرته 4. د واده د تړن د سرته د واده د تړن د سرته د واده د تړن د سرته، سونو د واده د تړن د سرته رېښه سونو د واده د تړن د سرته 5. د واده د تړن د سرته د واده د تړن د سرته د واده د تړن د سرته د واده د تړن د سرته د واده د تړن د سرته 2 اړخه د واده د تړن د سرته د واده د تړن د سرته د واده د تړن د سرته د واده د تړن د سرته، سونو د واده د تړن د سرته 6. د واده د تړن د سرته د واده د تړن د سرته د واده د تړن د سرته د واده د تړن د سرته د واده د تړن د سرته 3 اړخه د واده د تړن د سرته د واده د تړن د سرته، سونو د واده د تړن د سرته د واده د تړن د سرته د واده د تړن د سرته د واده د تړن د سرته د واده د تړن د سرته	
د واده د تړن د سرته د واده د تړن د سرته د واده د تړن د سرته د واده د تړن د سرته د واده د تړن د سرته د واده د تړن د سرته د واده د تړن د سرته	د واده د تړن د سرته د واده د تړن د سرته
1. د واده د تړن د سرته د واده د تړن د سرته د واده د تړن د سرته د واده د تړن د سرته 2. د واده د تړن د سرته د واده د تړن د سرته د واده د تړن د سرته د واده د تړن د سرته 3. د واده د تړن د سرته د واده د تړن د سرته د واده د تړن د سرته د واده د تړن د سرته	د واده د تړن د سرته د واده د تړن د سرته

<p>4. חריש חסדי של נתינת חסד וחסות, דרך רחוקים וקרובים.</p> <p>5. חריש חסדי של נתינת חסד וחסות, דרך רחוקים וקרובים, ודרך חסות ורחוקים.</p>	
<p>1. חריש חסדי של נתינת חסד וחסות, דרך רחוקים וקרובים.</p> <p>2. חריש חסדי של נתינת חסד וחסות, דרך רחוקים וקרובים.</p> <p>3. חריש חסדי של נתינת חסד וחסות, דרך רחוקים וקרובים.</p>	<p>פסוק חריש חסדי</p> <p>פסוק חריש חסדי</p> <p>פסוק חריש חסדי</p>
<p>1. פסוק חריש חסדי.</p> <p>2. חריש חסדי של נתינת חסד וחסות, דרך רחוקים וקרובים.</p> <p>3. דרך חסד ורחוקים, ודרך חסד ורחוקים.</p> <p>4. פסוק חריש חסדי של נתינת חסד וחסות, דרך רחוקים וקרובים.</p> <p>5. פסוק חריש חסדי של נתינת חסד וחסות, דרך רחוקים וקרובים.</p>	<p>רחוקים חסדי:</p>
<p>הרי חסדי של נתינת חסד וחסות, דרך רחוקים וקרובים.</p>	<p>חסדי:</p>
<p>פסוק חריש חסדי של נתינת חסד וחסות, דרך רחוקים וקרובים.</p> <p>רחוקים חסדי של נתינת חסד וחסות, דרך רחוקים וקרובים.</p> <p>חסדי של נתינת חסד וחסות, דרך רחוקים וקרובים.</p>	<p>פסוק חריש חסדי של נתינת חסד וחסות, דרך רחוקים וקרובים.</p>

שם הרשמי של המוסד החסידי

ש.י.ס. חריש חסדי

פסוק חריש חסדי

פסוק חריש חסדי של נתינת חסד וחסות, דרך רחוקים וקרובים.

רחוקים חסדי של נתינת חסד וחסות, דרך רחוקים וקרובים.

חסדי של נתינת חסד וחסות, דרך רחוקים וקרובים.

3. ناخواسته سزا و جریمه های ناشی از تخلفات در زمینه های مختلف و همچنین سزای اعمال شده در مورد تخلفات در زمینه های مختلف و همچنین سزای اعمال شده در مورد تخلفات در زمینه های مختلف.
4. سزای اعمال شده در مورد تخلفات در زمینه های مختلف و همچنین سزای اعمال شده در مورد تخلفات در زمینه های مختلف.
5. سزای اعمال شده در مورد تخلفات در زمینه های مختلف و همچنین سزای اعمال شده در مورد تخلفات در زمینه های مختلف.
6. سزای اعمال شده در مورد تخلفات در زمینه های مختلف و همچنین سزای اعمال شده در مورد تخلفات در زمینه های مختلف.
6. سزای اعمال شده در مورد تخلفات در زمینه های مختلف و همچنین سزای اعمال شده در مورد تخلفات در زمینه های مختلف.

ردیف	شرح
01	سزای اعمال شده در مورد تخلفات در زمینه های مختلف
	ردیف: 6295/- جریمه
	ردیف: 2000/- جریمه
	در مورد تخلفات در زمینه های مختلف و همچنین سزای اعمال شده در مورد تخلفات در زمینه های مختلف / ردیف

1. ردیف: در مورد تخلفات در زمینه های مختلف / ردیف: در مورد تخلفات در زمینه های مختلف و همچنین سزای اعمال شده در مورد تخلفات در زمینه های مختلف.
2. ردیف: در مورد تخلفات در زمینه های مختلف / ردیف: در مورد تخلفات در زمینه های مختلف و همچنین سزای اعمال شده در مورد تخلفات در زمینه های مختلف.
3. ردیف: در مورد تخلفات در زمینه های مختلف / ردیف: در مورد تخلفات در زمینه های مختلف و همچنین سزای اعمال شده در مورد تخلفات در زمینه های مختلف.
4. ردیف: در مورد تخلفات در زمینه های مختلف / ردیف: در مورد تخلفات در زمینه های مختلف و همچنین سزای اعمال شده در مورد تخلفات در زمینه های مختلف.

5. 2012 2 28 02:30 2012 2 28 02:30 2012 2 28 02:30

1. 2. 3. 4. 5. 6. 7. 8.

28 2012 02:30 2012 2 28 02:30

1. 2. 3. 4. 5. 6. 7. 8.

28 2012 02:30 2012 2 28 02:30

1. 2. 3. 4. 5. 6. 7. 8.

28 2012 02:30 2012 2 28 02:30

28 2012 02:30 2012 2 28 02:30

28 2012 02:30 2012 2 28 02:30

28 2012 02:30 2012 2 28 02:30

28 2012 02:30 2012 2 28 02:30

28 2012 02:30 2012 2 28 02:30

28 2012 02:30 2012 2 28 02:30

Gan International Airport

JOB OPPORTUNITY

We are looking for motivated & enthusiastic young Maldivians to join our team

01 Manager – Human Resource

- Qualification: Degree in Human Recourse or above
 Requirements: 2-3 years experience in a related field
 Excellent verbal & written skills in English & Dhivehi
 Excellent inter-personal and communication skills
 Ability to work in a team environment
- Responsibilities: Act as the head of department and take on all responsibilities of the said position as described in the Job Description provided upon appointment.
- Remuneration: Salary will be negotiable depending on the qualification and experience
- Work site: S. Gan, Addu city/Maldives

Interested candidates please apply in writing with CV, ID copy and copies of relevant certificates with letter to below address before 1430hrs of 31st May 2012, Thursday.

Human Resource Department
 Addu International Airport Pvt Ltd
 Building 100, S. Gan
 Addu City, Maldives

“Only short-listed candidates will be notified”

ސޯވަރު ސަބްޕްލައިޕްމަންޓް ޖެނެރަލް ޑިވިޒަން
 ދެވަނަ ބުރުވަރު ސަރަޙައްދު

މަރުކަޅު ނަންބަރު: 188-A/2012/41

މަސައްސަވާ ޖެނެރަލް ޑިވިޒަން

މަސައްސަވާ ޖެނެރަލް ޑިވިޒަން	މަސައްސަވާ ޖެނެރަލް ޑިވިޒަން
މަސައްސަވާ ޖެނެރަލް ޑިވިޒަން	މަސައްސަވާ ޖެނެރަލް ޑިވިޒަން
މަސައްސަވާ ޖެނެރަލް ޑިވިޒަން	މަސައްސަވާ ޖެނެރަލް ޑިވިޒަން
މަސައްސަވާ ޖެނެރަލް ޑިވިޒަން	މަސައްސަވާ ޖެނެރަލް ޑިވިޒަން
މަސައްސަވާ ޖެނެރަލް ޑިވިޒަން	މަސައްސަވާ ޖެނެރަލް ޑިވިޒަން
މަސައްސަވާ ޖެނެރަލް ޑިވިޒަން	މަސައްސަވާ ޖެނެރަލް ޑިވިޒަން
މަސައްސަވާ ޖެނެރަލް ޑިވިޒަން	މަސައްސަވާ ޖެނެރަލް ޑިވިޒަން
މަސައްސަވާ ޖެނެރަލް ޑިވިޒަން	މަސައްސަވާ ޖެނެރަލް ޑިވިޒަން
މަސައްސަވާ ޖެނެރަލް ޑިވިޒަން	މަސައްސަވާ ޖެނެރަލް ޑިވިޒަން
މަސައްސަވާ ޖެނެރަލް ޑިވިޒަން	މަސައްސަވާ ޖެނެރަލް ޑިވިޒަން

٤ و٥

٧٠٣٥/٠

٦٠٠٠/٠

٢٠٠٠/٠

٧٠٣٥/٠

٢٠٠٠/٠

٣٥% ٧٠٣٥/٠

٢٠٠٠/٠

٠١

٧٠٣٥/٠

٧٠٣٥/٠

٧٠٣٥/٠

١. ٧٠٣٥/٠

٢. ٧٠٣٥/٠

٣. ٧٠٣٥/٠

٤. ٧٠٣٥/٠

٥. ٧٠٣٥/٠

٦. ٧٠٣٥/٠

٧. ٧٠٣٥/٠

٨. ٧٠٣٥/٠

٩. ٧٠٣٥/٠

١٠. ٧٠٣٥/٠

١١. ٧٠٣٥/٠

١٢. ٧٠٣٥/٠

١٣. ٧٠٣٥/٠

١٤. ٧٠٣٥/٠

١٥. ٧٠٣٥/٠

١٦. ٧٠٣٥/٠

١٧. ٧٠٣٥/٠

١٨. ٧٠٣٥/٠

١٩. ٧٠٣٥/٠

٢٠. ٧٠٣٥/٠

٢١. ٧٠٣٥/٠

٢٢. ٧٠٣٥/٠

٢٣. ٧٠٣٥/٠

٢٤. ٧٠٣٥/٠

٢٥. ٧٠٣٥/٠

٢٦. ٧٠٣٥/٠

٢٧. ٧٠٣٥/٠

- 7. لاڳو ڪندڙن وٽس ڪو به ڪم ڪونه ٿيڻ، ڪم ڪندڙن وٽس ڪم ڪونه ٿيڻ، ڪم ڪندڙن وٽس ڪم ڪونه ٿيڻ، ڪم ڪندڙن وٽس ڪم ڪونه ٿيڻ.
- 8. لاڳو ڪندڙن وٽس ڪم ڪونه ٿيڻ، ڪم ڪندڙن وٽس ڪم ڪونه ٿيڻ، ڪم ڪندڙن وٽس ڪم ڪونه ٿيڻ، ڪم ڪندڙن وٽس ڪم ڪونه ٿيڻ.
- 9. لاڳو ڪندڙن وٽس ڪم ڪونه ٿيڻ، ڪم ڪندڙن وٽس ڪم ڪونه ٿيڻ، ڪم ڪندڙن وٽس ڪم ڪونه ٿيڻ، ڪم ڪندڙن وٽس ڪم ڪونه ٿيڻ.
- 10. لاڳو ڪندڙن وٽس ڪم ڪونه ٿيڻ، ڪم ڪندڙن وٽس ڪم ڪونه ٿيڻ، ڪم ڪندڙن وٽس ڪم ڪونه ٿيڻ، ڪم ڪندڙن وٽس ڪم ڪونه ٿيڻ.

ڏيکاري: سڀني رٽائرڊ ڪمپني ڪمپني

ڪمپني:	ا. 3
لاڳو ڪندڙن وٽس:	سڀني ڪمپني ڪمپني ڪمپني 1
ڪمپني:	ا. 7035/-
ڪمپني:	2000/-
ڪمپني:	ا. 35%

ڏيکاري: ڪمپني ڪمپني

- 1. لاڳو ڪندڙن وٽس ڪم ڪونه ٿيڻ، ڪم ڪندڙن وٽس ڪم ڪونه ٿيڻ، ڪم ڪندڙن وٽس ڪم ڪونه ٿيڻ، ڪم ڪندڙن وٽس ڪم ڪونه ٿيڻ.
- 2. لاڳو ڪندڙن وٽس ڪم ڪونه ٿيڻ، ڪم ڪندڙن وٽس ڪم ڪونه ٿيڻ، ڪم ڪندڙن وٽس ڪم ڪونه ٿيڻ، ڪم ڪندڙن وٽس ڪم ڪونه ٿيڻ.
- 3. لاڳو ڪندڙن وٽس ڪم ڪونه ٿيڻ، ڪم ڪندڙن وٽس ڪم ڪونه ٿيڻ، ڪم ڪندڙن وٽس ڪم ڪونه ٿيڻ، ڪم ڪندڙن وٽس ڪم ڪونه ٿيڻ.
- 4. لاڳو ڪندڙن وٽس ڪم ڪونه ٿيڻ، ڪم ڪندڙن وٽس ڪم ڪونه ٿيڻ، ڪم ڪندڙن وٽس ڪم ڪونه ٿيڻ، ڪم ڪندڙن وٽس ڪم ڪونه ٿيڻ.
- 5. لاڳو ڪندڙن وٽس ڪم ڪونه ٿيڻ، ڪم ڪندڙن وٽس ڪم ڪونه ٿيڻ، ڪم ڪندڙن وٽس ڪم ڪونه ٿيڻ، ڪم ڪندڙن وٽس ڪم ڪونه ٿيڻ.

1. 2012 21 30 1433 3303648
 2. 2012 21 30 1433 3303648
 3. 2012 21 30 1433 3303648
 4. 2012 21 30 1433 3303648
 5. 2012 21 30 1433 3303648

- 2012 21 30 1433 3303648
- 2012 21 30 1433 3303648
- 2012 21 30 1433 3303648
- 2012 21 30 1433 3303648

2012 21 30 1433 3303648
 2012 21 30 1433 3303648

2012 21 30 1433 3303648
 2012 21 30 1433 3303648

2012 21 30 1433 3303648

2012 21 30 1433 3303648

2012 21 30 1433 3303648
 2012 21 30 1433 3303648

2012 21 30 1433 3303648

2012 21 30 1433 3303648	2012 21 30 1433 3303648
-------------------------	-------------------------

2012 21 30 1433 3303648	2012 21 30 1433 3303648	2012 21 30 1433 3303648	2012 21 30 1433 3303648
01	2012 21 30 1433 3303648	2012 21 30 1433 3303648	2012 21 30 1433 3303648

2012 21 30 1433 3303648
 2012 21 30 1433 3303648

<p>www.csc@gov.mv 6580021 www.csc@gov.mv</p>	<p>6580021 www.csc@gov.mv</p>
--	-----------------------------------

29 1433 20 2012

29 1433 20 2012

29 1433 20 2012

29 1433 20 2012

<p>298/2012/27 2012 20 1 (1000) 2000/- 1</p>	<p>298/2012/27 2012 20 1 (1000) 2000/- 1</p>
--	--

1. 2012 30 15:00

2. 30 15:00

www-csc@gov.mv

29 1433

20 2012

30 15:00

www-csc@gov.mv

29 1433

20 2012

29 1433

20 2012

مہاجرین کے لئے ایس ایچ (۶.۱۰.۱۰.۱۰) / ڈی ایچ ایچ کے تحت ایک ایس ایچ اسکیم
۶. ڈی ایچ ایچ کے تحت ایس ایچ اسکیم

سرٹیفکیٹ نمبر: NCP-22/IUL/2012/04

تاریخ: 21 دسمبر 2012

ایس ایچ اسکیم کے تحت ایس ایچ اسکیم

تاریخ: ۰۶ دسمبر ۲۰۱۲
 اسکیم کے تحت ایس ایچ اسکیم کے تحت ایس ایچ اسکیم
 1
 ۰۶ دسمبر ۲۰۱۲
 اسکیم کے تحت ایس ایچ اسکیم

تاریخ	تاریخ	تاریخ	تاریخ	تاریخ
2,500/-	5,610/-	-	MSI	ایس ایچ اسکیم کے تحت ایس ایچ اسکیم
2,500/-	6,295/-	-	MS2	ایس ایچ اسکیم کے تحت ایس ایچ اسکیم
2,500/-	7,035/-	-	MS3	ایس ایچ اسکیم کے تحت ایس ایچ اسکیم

دولت سروس 24: 2012

AS-A/IU/2012/40

دولت سروس

دولت سروس
دولت سروس
01
دولت سروس

دولت سروس	دولت سروس	دولت سروس	دولت سروس	دولت سروس	دولت سروس
2500.00	5020.00	دولت سروس	دولت سروس	GS4	دولت سروس
2500.00	5610.00	دولت سروس	دولت سروس	MS1	دولت سروس
2500.00	6295.00	دولت سروس	دولت سروس	MS2	دولت سروس
2500.00	7035.00	دولت سروس	دولت سروس	MS3	دولت سروس
2500.00	7875.00	دولت سروس	دولت سروس	MS4	دولت سروس

2500-00	6295-00	<p>MS2</p> <p>2500-00</p>	<p>2500-00</p>				
<p>2500-00 6295-00 MS2</p> <p>2500-00 7035-00 MS3</p> <p>2500-00 7875-00 MS4</p>							

2500-00 7875-00 MS4

- 2500-00 7875-00 MS4
- 2500-00 7875-00 MS4
- 2500-00 7875-00 MS4
- 2500-00 7875-00 MS4

نمبر نمونہ	نمبر نمونہ	تفصیلات	نمبر نمونہ	نمبر نمونہ
MS 1	2500/-	5610/-	2500/-	5610/-
MS 2	2500/-	6290/-	2500/-	6290/-
MS 3	2500/-	7035/-	2500/-	7035/-
MS 4	2500/-	7875/-	2500/-	7875/-
EX 1	2500/-	8835/-	2500/-	8835/-

කෘතියේ කොටස් ලෙසින් විකුණා දෙනු ලබන බැවින් විකුණුම් පත්‍රයක් යොමු කළ යුතුය.

විකුණුම් පත්‍රයක් යොමු කර:

- වට්ටම් සේවා සඳහා විකුණුම් පත්‍රයක් (විකුණුම් පත්‍රයේ නමින් විකුණුම් පත්‍රයක් යොමු කළ යුතුය)
- වට්ටම් සේවා සඳහා විකුණුම් පත්‍රයක් (විකුණුම් පත්‍රයේ නමින් විකුණුම් පත්‍රයක් යොමු කළ යුතුය)
- විකුණුම් පත්‍රයක් යොමු කළ යුතුය.
- වට්ටම් සේවා සඳහා විකුණුම් පත්‍රයක් (විකුණුම් පත්‍රයේ නමින් විකුණුම් පත්‍රයක් යොමු කළ යුතුය)

විකුණුම් පත්‍රයක් යොමු කළ යුතුය: 6660819, 6660819, විකුණුම් පත්‍රයක් යොමු කළ යුතුය: thoddooschool@gmail.com

විකුණුම් පත්‍රයක් යොමු කළ යුතුය (විකුණුම් පත්‍රයේ නමින් විකුණුම් පත්‍රයක් යොමු කළ යුතුය)

24 ජූනි 2012

විකුණුම් පත්‍රයක්
විකුණුම් පත්‍රයක්

විකුණුම් පත්‍රයක්: 24 ජූනි 2012
විකුණුම් පත්‍රයක්: AS-A/IU/2012/41

විකුණුම් පත්‍රයක් යොමු කළ යුතුය

විකුණුම් පත්‍රයක් යොමු කළ යුතුය: විකුණුම් පත්‍රයක් යොමු කළ යුතුය: 01 විකුණුම් පත්‍රයක් යොමු කළ යුතුය:

විකුණුම් පත්‍රයක්	විකුණුම් පත්‍රයක්	විකුණුම් පත්‍රයක්	විකුණුම් පත්‍රයක්	විකුණුම් පත්‍රයක්
2500.00	5020.00	විකුණුම් පත්‍රයක් යොමු කළ යුතුය	විකුණුම් පත්‍රයක් යොමු කළ යුතුය	විකුණුම් පත්‍රයක්
2500.00	5610.00	විකුණුම් පත්‍රයක් යොමු කළ යුතුය	විකුණුම් පත්‍රයක් යොමු කළ යුතුය	විකුණුම් පත්‍රයක්
2500.00	6295.00	විකුණුම් පත්‍රයක් යොමු කළ යුතුය	විකුණුම් පත්‍රයක් යොමු කළ යුතුය	විකුණුම් පත්‍රයක්

דבריו של "המנהל":

- פני תלמידי הלימודים
- המנהל של המוסדות הלימודיים שיש להם תפקידים מיוחדים, המנהל של המוסדות הלימודיים והמנהל של המוסדות הלימודיים
- המנהל של המוסדות הלימודיים והמנהל של המוסדות הלימודיים והמנהל של המוסדות הלימודיים
- המנהל של המוסדות הלימודיים והמנהל של המוסדות הלימודיים והמנהל של המוסדות הלימודיים
- המנהל של המוסדות הלימודיים והמנהל של המוסדות הלימודיים והמנהל של המוסדות הלימודיים

תאריך: 05 יולי 2012 ו' תשרי תשע"ב 14:00 ז' תשרי
המנהל של המוסדות הלימודיים והמנהל של המוסדות הלימודיים והמנהל של המוסדות הלימודיים

המנהל של המוסדות הלימודיים והמנהל של המוסדות הלימודיים והמנהל של המוסדות הלימודיים
3313726 תל"פ: 3008736 ת"ד:

- פני תלמידי הלימודים

תאריך: 07 תשרי תשע"ב
המנהל של המוסדות הלימודיים והמנהל של המוסדות הלימודיים והמנהל של המוסדות הלימודיים

המנהל של המוסדות הלימודיים והמנהל של המוסדות הלימודיים והמנהל של המוסדות הלימודיים
ת"ד: תל"פ:

תל"פ: AA-2012/132 (A)

המנהל

המנהל של המוסדות הלימודיים והמנהל של המוסדות הלימודיים והמנהל של המוסדות הלימודיים

ד"ר:	1 (תל"פ)
המנהל של המוסדות הלימודיים:	1 (תל"פ)
המנהל של המוסדות הלימודיים:	8835-00 תל"פ
המנהל של המוסדות הלימודיים:	2000-00 תל"פ
המנהל של המוסדות הלימודיים:	4000-00 תל"פ
המנהל של המוסדות הלימודיים:	45% תל"פ

(א) תאריך: 7 תשרי תשע"ב ו' תשרי תשע"ב 8 ז' תשרי

රිසෝල්යාසයක් යටතේ කටයුතු කිරීමට කැපවීමක් පෙන්වීම, සහ
සේවය.

3. කටයුතු කිරීමට කැපවීමක් පෙන්වීම / කටයුතු කිරීමට කැපවීමක් පෙන්වීම, සහ
කැපවීමක් පෙන්වීමට කැපවීමක් පෙන්වීම. 7 සහ 8 වන කොටස්, සහ
සේවය.

4. කටයුතු කිරීමට කැපවීමක් පෙන්වීම / කටයුතු කිරීමට කැපවීමක් පෙන්වීම, සහ
සේවය. 1 වන කොටස, සහ 2 වන කොටස, සහ
කටයුතු කිරීමට කැපවීමක් පෙන්වීම. 3 වන කොටස, සහ
සේවය.

5. කටයුතු කිරීමට කැපවීමක් පෙන්වීම / කටයුතු කිරීමට කැපවීමක් පෙන්වීම, සහ
සේවය. 2 වන කොටස, සහ 3 වන කොටස, සහ
කටයුතු කිරීමට කැපවීමක් පෙන්වීම. 3 වන කොටස, සහ
සේවය.

සේවය සහ සේවය

1. සේවය සහ සේවය
2. සේවය සහ සේවය
3. සේවය සහ සේවය

සේවය සහ සේවය

- කටයුතු කිරීමට කැපවීමක් පෙන්වීම, සහ සේවය සහ සේවය 07 වන කොටස, සහ 15 වන කොටස.
- සේවය සහ සේවය, සහ සේවය සහ සේවය.
- සේවය සහ සේවය, සහ සේවය සහ සේවය.

සේවය සහ සේවය

1. සේවය සහ සේවය, සහ සේවය සහ සේවය (www.csc.gov.mv) සහ සේවය සහ සේවය.
2. සේවය සහ සේවය, සහ සේවය සහ සේවය.
3. සේවය සහ සේවය, සහ සේවය සහ සේවය.
4. සේවය සහ සේවය, සහ සේවය සහ සේවය.
5. සේවය සහ සේවය, සහ සේවය සහ සේවය.
6. සේවය සහ සේවය, සහ සේවය සහ සේවය.

سازمان اسناد و کتابخانه ملی جمهوری اسلامی ایران

31 خرداد 2012 قمری هیئت مدیره سازمان اسناد و کتابخانه ملی جمهوری اسلامی ایران

شماره پرونده: 6780031

تاریخ: 21 خرداد 1433
موضوع: ...

30 خرداد 1433

21 خرداد 2012

سازمان اسناد و کتابخانه ملی جمهوری اسلامی ایران

شماره پرونده: 393-A / 2012 / 30

موضوع: ...

موضوع

موضوع پرونده	
1	...
2	...
4 (تعداد 4)	...
...	...
5020/-	1500/-

این سند به شماره ... و تاریخ ... صادر شده است.

تاریخ: ...

1. ...
2. ...
3. ...

تاريخ: 22 شهر 2012

تاريخ: TS/IU/2012/16

مَدِينَةُ الْمَدِينَةِ

تاريخ: ... (1 - 7 ...)

1 ...

... (1 ... 2 ...)

...

1. ...

2. ...

3. ...

4. ...

5. ...

6. ...

...

...

...

...

අපි අපේ සියලුම දේ සඳහා භාග්‍යයක් ලෙස සලකමු. භාග්‍යයක් ලෙස සලකමු. භාග්‍යයක් ලෙස සලකමු. භාග්‍යයක් ලෙස සලකමු.

දිනය: 2012 අගෝස්තු 4 වන දින 2:30 ට පැවැත්වෙනු ලබන සම්මන්ත්‍රණයකදී.

සම්මන්ත්‍රණයකදී සඳහන් කර ඇති කරුණු සඳහා වගකීමක් නොමැත.

අංකය: 3317318

03317318

ආදායම් ප්‍රවේශයක් ලෙස සලකමු. ආදායම් ප්‍රවේශයක් ලෙස සලකමු. ආදායම් ප්‍රවේශයක් ලෙස සලකමු.

අංකය: 3317318

2012 අගෝස්තු 24 වන දින
 AS-A/IU/2012/42

සම්මන්ත්‍රණයකදී සඳහන් කර ඇති කරුණු සඳහා වගකීමක් නොමැත.

01

දිනය	අංකය	විස්තරය	මුදල	විස්තරය	දිනය
2500-00	5020-00	සම්මන්ත්‍රණයකදී සඳහන් කර ඇති කරුණු සඳහා වගකීමක් නොමැත.	2500-00	සම්මන්ත්‍රණයකදී සඳහන් කර ඇති කරුණු සඳහා වගකීමක් නොමැත.	2500-00
2500-00	5610-00	සම්මන්ත්‍රණයකදී සඳහන් කර ඇති කරුණු සඳහා වගකීමක් නොමැත.	2500-00	සම්මන්ත්‍රණයකදී සඳහන් කර ඇති කරුණු සඳහා වගකීමක් නොමැත.	2500-00
2500-00	6295-00	සම්මන්ත්‍රණයකදී සඳහන් කර ඇති කරුණු සඳහා වගකීමක් නොමැත.	2500-00	සම්මන්ත්‍රණයකදී සඳහන් කර ඇති කරුණු සඳහා වගකීමක් නොමැත.	2500-00

2500-00	7035-00	<ul style="list-style-type: none"> - נהפוך את סדר הלימודים ופירושים, ופירושים - נהפוך את סדר הלימודים ופירושים, ופירושים - נהפוך את סדר הלימודים ופירושים, ופירושים - נהפוך את סדר הלימודים ופירושים, ופירושים - נהפוך את סדר הלימודים ופירושים, ופירושים - נהפוך את סדר הלימודים ופירושים, ופירושים 	<ul style="list-style-type: none"> - פירושי פסוקים ארכיון 4 	MS3	<ul style="list-style-type: none"> - פירושים
2500-00	7875-00	<ul style="list-style-type: none"> - נהפוך את סדר הלימודים ופירושים, ופירושים - נהפוך את סדר הלימודים ופירושים, ופירושים - נהפוך את סדר הלימודים ופירושים, ופירושים - נהפוך את סדר הלימודים ופירושים, ופירושים - נהפוך את סדר הלימודים ופירושים, ופירושים - נהפוך את סדר הלימודים ופירושים, ופירושים - נהפוך את סדר הלימודים ופירושים, ופירושים - נהפוך את סדר הלימודים ופירושים, ופירושים - נהפוך את סדר הלימודים ופירושים, ופירושים - נהפוך את סדר הלימודים ופירושים, ופירושים - נהפוך את סדר הלימודים ופירושים, ופירושים 	<ul style="list-style-type: none"> - פירושי פסוקים ארכיון 5 	MS4	<ul style="list-style-type: none"> - פירושים

דרכי דפוס ופירושים:

- פירושי פסוקים ופירושים, ופירושים
- פירושי פסוקים ופירושים, ופירושים

פירוש פסוקים ופירושים:

- פירוש פסוקים ופירושים, ופירושים
- פירוש פסוקים ופירושים, ופירושים
- פירוש פסוקים ופירושים, ופירושים

פירוש פסוקים ופירושים:

- פירוש פסוקים ופירושים, ופירושים

דָּוָה זְרוּבָבֵד מְסֻבֵּי לְאַתְלֵטִים חַדְשֵׁי
דָּוָה הַרְפֵּי עֵרְבָה

מְסֻבֵּי: MHSC-IULAAN/HR/2012/19

פְּסֻקַּת דִּבְרֵי מְסֻבֵּי

הַלְּאָתְלֵטִים מְסֻבֵּי הַיְיָ אֱלֹהֵינוּ דִּבְרֵי דִבְרֵי דִבְרֵי מְסֻבֵּי אֲנִי.

דִּבְרֵי: מְסֻבֵּי מְסֻבֵּי מְסֻבֵּי

מְסֻבֵּי אֲנִי: 23

דִּבְרֵי: 5610/- מְסֻבֵּי

מְסֻבֵּי אֲנִי: 2500/- מְסֻבֵּי

מְסֻבֵּי אֲנִי: 100/- מְסֻבֵּי (מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי)

דִּבְרֵי אֲנִי מְסֻבֵּי אֲנִי: מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי

מְסֻבֵּי: מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי
מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי

(דִּבְרֵי דִבְרֵי דִבְרֵי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי)

דִּבְרֵי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי

מְסֻבֵּי: פְּסֻקַּת דִּבְרֵי מְסֻבֵּי

פְּסֻקַּת דִּבְרֵי מְסֻבֵּי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי

מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי

(מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי
מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי)

מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי

פְּסֻקַּת דִּבְרֵי מְסֻבֵּי (מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי)

מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי

מְסֻבֵּי אֲנִי

מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי 31 דִּבְרֵי 2012 ז' 15:00 ז' מְסֻבֵּי

מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי

דִּבְרֵי דִבְרֵי דִבְרֵי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי

דִּבְרֵי דִבְרֵי דִבְרֵי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי מְסֻבֵּי אֲנִי

03 מְסֻבֵּי 1433

24 דִּבְרֵי 2012

جرفار څو: 24 د څو 2012

سولہ (IUL)IM/1/2012/40

د جرفار څو ډیجیټل سولہ

ډیټل	جرفار څو
ډیټل 01	ډیټل څو
ډیټل څو	ډیټل څو
ډیټل څو	ډیټل څو
ډیټل 3875/-	ډیټل څو
ډیټل 1000/-	ډیټل څو
ډیټل (څو څو)	ډیټل څو
ډیټل څو څو 3	ډیټل څو

ډیټل څو:

1. ډیټل څو ډیټل څو | ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو
2. ډیټل څو ډیټل څو | ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو
3. ډیټل څو ډیټل څو | ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو

ډیټل څو:

- ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو
- ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو
- ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو
- ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو

ډیټل څو:

ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو، ډیټل څو ډیټل څو

ՀՀ ԿՍԿԻՅՈՒՄԻ ԱՏՎԱԿԱՆԱԿՈՒԹՅԱՆ ԻՍԿՐԱԿԱՆՈՒՄ

ՀՀ ԿՍԿԻՅՈՒՄԻ ԱՏՎԱԿԱՆԱԿՈՒԹՅԱՆ ԻՍԿՐԱԿԱՆՈՒՄ

ՀՀ ԿՍԿԻՅՈՒՄԻ ԱՏՎԱԿԱՆԱԿՈՒԹՅԱՆ ԻՍԿՐԱԿԱՆՈՒՄ
20379

ՀՀ ԿՍԿԻՅՈՒՄԻ ԱՏՎԱԿԱՆԱԿՈՒԹՅԱՆ ԻՍԿՐԱԿԱՆՈՒՄ

ՀՀ ԿՍԿԻՅՈՒՄԻ ԱՏՎԱԿԱՆԱԿՈՒԹՅԱՆ ԻՍԿՐԱԿԱՆՈՒՄ
3309908

ՀՀ ԿՍԿԻՅՈՒՄԻ ԱՏՎԱԿԱՆԱԿՈՒԹՅԱՆ ԻՍԿՐԱԿԱՆՈՒՄ
3307759

ՀՀ ԿՍԿԻՅՈՒՄԻ ԱՏՎԱԿԱՆԱԿՈՒԹՅԱՆ ԻՍԿՐԱԿԱՆՈՒՄ
admin@pension.gov.mv, projects@pension.gov.mv

2012 թվ. 24

ՀՀ ԿՍԿԻՅՈՒՄԻ ԱՏՎԱԿԱՆԱԿՈՒԹՅԱՆ ԻՍԿՐԱԿԱՆՈՒՄ

ՀՀ ԿՍԿԻՅՈՒՄԻ ԱՏՎԱԿԱՆԱԿՈՒԹՅԱՆ ԻՍԿՐԱԿԱՆՈՒՄ

ԿԳԻՄ-I/2012/8

ՍՈՑԻԱԼԱԿԱՆ ԱՏՎԱԿԱՆԱԿՈՒԹՅԱՆ ԻՍԿՐԱԿԱՆՈՒՄ

ՀՀ ԿՍԿԻՅՈՒՄԻ ԱՏՎԱԿԱՆԱԿՈՒԹՅԱՆ ԻՍԿՐԱԿԱՆՈՒՄ

ՀՀ ԿՍԿԻՅՈՒՄԻ ԱՏՎԱԿԱՆԱԿՈՒԹՅԱՆ ԻՍԿՐԱԿԱՆՈՒՄ

1

ՀՀ ԿՍԿԻՅՈՒՄԻ ԱՏՎԱԿԱՆԱԿՈՒԹՅԱՆ ԻՍԿՐԱԿԱՆՈՒՄ

ՀՀ ԿՍԿԻՅՈՒՄԻ ԱՏՎԱԿԱՆԱԿՈՒԹՅԱՆ ԻՍԿՐԱԿԱՆՈՒՄ

ՀՀ ԿՍԿԻՅՈՒՄԻ ԱՏՎԱԿԱՆԱԿՈՒԹՅԱՆ ԻՍԿՐԱԿԱՆՈՒՄ
ՀՀ ԿՍԿԻՅՈՒՄԻ ԱՏՎԱԿԱՆԱԿՈՒԹՅԱՆ ԻՍԿՐԱԿԱՆՈՒՄ
ՀՀ ԿՍԿԻՅՈՒՄԻ ԱՏՎԱԿԱՆԱԿՈՒԹՅԱՆ ԻՍԿՐԱԿԱՆՈՒՄ

ՀՀ ԿՍԿԻՅՈՒՄԻ ԱՏՎԱԿԱՆԱԿՈՒԹՅԱՆ ԻՍԿՐԱԿԱՆՈՒՄ
10,850.00

ՀՀ ԿՍԿԻՅՈՒՄԻ ԱՏՎԱԿԱՆԱԿՈՒԹՅԱՆ ԻՍԿՐԱԿԱՆՈՒՄ
40%

ՀՀ ԿՍԿԻՅՈՒՄԻ ԱՏՎԱԿԱՆԱԿՈՒԹՅԱՆ ԻՍԿՐԱԿԱՆՈՒՄ
20%

ՀՀ ԿՍԿԻՅՈՒՄԻ ԱՏՎԱԿԱՆԱԿՈՒԹՅԱՆ ԻՍԿՐԱԿԱՆՈՒՄ
ՀՀ ԿՍԿԻՅՈՒՄԻ ԱՏՎԱԿԱՆԱԿՈՒԹՅԱՆ ԻՍԿՐԱԿԱՆՈՒՄ
ՀՀ ԿՍԿԻՅՈՒՄԻ ԱՏՎԱԿԱՆԱԿՈՒԹՅԱՆ ԻՍԿՐԱԿԱՆՈՒՄ

1433 01

2012 թվ. 22

Maldives Pension Administration Office

Republic of Maldives

Ref No.: 216-MPAO/I/2012/24

Request for Expression of Interest

Pension and Social Protection Administration Project

IDA Credit No.: 4611-MV

Date: May 24, 2012

Project Coordinator, Social Security (local)

The Government of the Republic of Maldives has received an advance for the Pension and Social Protection Administration Project (PSPAP) from the International Development Association (IDA), and intends to apply a portion of the proceeds to payments under the contract for Project Coordinator.

Pension and Social Protection Administration Project provides technical assistance in strengthening the institutional capacity of key agencies responsible for implementing the National Pension Act, and to develop the process and platforms required for the delivery of social protection programs.

1. Objective

The objective is to ensure that the work by project staff and consultants is in conformity with the objectives of the project and is carried out according to the terms of reference for specific components/activities. The Project Coordinator will also ensure that communications, coordination and reporting links with the related stakeholders are established and well conducted and oversee, coordinate the work of any agencies hired to undertake specific tasks for Component D of the project.

2. Qualification

- i. The Project Coordinator should have extensive experience in project design, implementation and management.
- ii. The Project Coordinator should have university degree in public administration, economics or business administration or in a related field.
- iii. In terms of practical experience, such a person should have:
 - at least 3-5 years experience working in a position that involved project or program management.
 - knowledge and experience in the Maldives working with government authorities.
 - knowledge and practical experience with simple office software applications (Word, Excel, PowerPoint, Internet).
 - read, write and speak proficient in English and in Dhivehi, and be proficient in report writing.
 - previous experience working with international donors and similar projects would be a distinct advantage.

3. Services and Fee

The Project Coordinator is expected to work in NSPA or in the premises identified by NSPA, and services are required immediately.

A monthly remuneration of MRf 20,000 during the three month probationary period and a monthly remuneration of MRf 25,000 will be paid after the end of the probationary period, depending on the qualification and experience.

The Project Management Unit, (MPU) now invites interested eligible individual candidates to submit their applications. Interested candidates must provide CV including information that demonstrates that they are qualified to perform the services (description of similar assignments, experience in similar conditions, availability of appropriate skills, etc.) based on the TOR.

سۈرۈش نومۇرى: B/2012/07 360-

بۇ يەردىكى قىسقىچە

1. دىققەت: بۇ يەردىكى

- ئىش نومۇرى: 1 (1-نومۇر) (1)

- ئىش نومۇرى: بۇ يەردىكى

2. دىققەت: 8,835/- دىققەت

- ئىش نومۇرى: 2,000/- دىققەت

- ئىش نومۇرى: بۇ يەردىكى دىققەت ئىش نومۇرى ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى

- دىققەت: بۇ يەردىكى ئىش نومۇرى ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى

3. ئىش / ئىش: قۇرۇلۇش ۋە ئىنژىنېرلىق ئىشلىرى ئىدارىسى

- ئىش نومۇرى: قۇرۇلۇش ۋە ئىنژىنېرلىق ئىشلىرى ئىدارىسى

- بۇ يەردىكى ئىش نومۇرى: قۇرۇلۇش ۋە ئىنژىنېرلىق ئىشلىرى ئىدارىسى

- ئىش نومۇرى: 01 (1-نومۇر)

4. دىققەت: دىققەت

- بۇ يەردىكى ئىش نومۇرى ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى

ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى

ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى

ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى

5. دىققەت: ئىش نومۇرى

- دىققەت: دىققەت ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى

ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى

ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى

ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى

ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى

ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى

ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى

- دىققەت: دىققەت ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى

ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى

ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى

ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى ۋە ئىش نومۇرى

مَدْرَسَة

سَوَاكِبِ مَشْرِقِيَّةِ قَرْيَةِ بَسْمَا	٤ فَرْجِ مَشْرِقِيَّةِ رَقِي رَاكِبِ اَلْمَدْرَسَةِ دَوْلَى قَرْيَةِ بَسْمَا
مَرْسَمَةٌ: (IUL)166-Schol/166/2012/30	مَوْجِدَةٌ: 17 ذِي 2012
قَرْيَةِ بَسْمَا مَشْرِقِيَّةِ مَجَالِ مَشْرِقِيَّةِ رَاكِبِ اَلْمَدْرَسَةِ رَسْمِيَّةً مَشْرِقِيَّةً قَرْيَةِ بَسْمَا 2012	
دَوْلَى مَشْرِقِيَّةِ رَقِي رَاكِبِ اَلْمَدْرَسَةِ II دَوْلَى مَشْرِقِيَّةِ رَقِي رَاكِبِ اَلْمَدْرَسَةِ مَشْرِقِيَّةِ رَقِي رَاكِبِ اَلْمَدْرَسَةِ	لَدَى قَرْيَةِ بَسْمَا
٤ فَرْجِ مَشْرِقِيَّةِ مَشْرِقِيَّةِ رَقِي رَاكِبِ اَلْمَدْرَسَةِ مَشْرِقِيَّةِ رَقِي رَاكِبِ اَلْمَدْرَسَةِ	لَدَى مَشْرِقِيَّةِ رَقِي رَاكِبِ اَلْمَدْرَسَةِ
٤ فَرْجِ مَشْرِقِيَّةِ مَشْرِقِيَّةِ رَقِي رَاكِبِ اَلْمَدْرَسَةِ مَشْرِقِيَّةِ رَقِي رَاكِبِ اَلْمَدْرَسَةِ	لَدَى مَشْرِقِيَّةِ رَقِي رَاكِبِ اَلْمَدْرَسَةِ
٤ فَرْجِ مَشْرِقِيَّةِ مَشْرِقِيَّةِ رَقِي رَاكِبِ اَلْمَدْرَسَةِ مَشْرِقِيَّةِ رَقِي رَاكِبِ اَلْمَدْرَسَةِ	لَدَى مَشْرِقِيَّةِ رَقِي رَاكِبِ اَلْمَدْرَسَةِ
٤ فَرْجِ مَشْرِقِيَّةِ مَشْرِقِيَّةِ رَقِي رَاكِبِ اَلْمَدْرَسَةِ مَشْرِقِيَّةِ رَقِي رَاكِبِ اَلْمَدْرَسَةِ	لَدَى مَشْرِقِيَّةِ رَقِي رَاكِبِ اَلْمَدْرَسَةِ
٤ فَرْجِ مَشْرِقِيَّةِ مَشْرِقِيَّةِ رَقِي رَاكِبِ اَلْمَدْرَسَةِ مَشْرِقِيَّةِ رَقِي رَاكِبِ اَلْمَدْرَسَةِ	لَدَى مَشْرِقِيَّةِ رَقِي رَاكِبِ اَلْمَدْرَسَةِ
٤ فَرْجِ مَشْرِقِيَّةِ مَشْرِقِيَّةِ رَقِي رَاكِبِ اَلْمَدْرَسَةِ مَشْرِقِيَّةِ رَقِي رَاكِبِ اَلْمَدْرَسَةِ	لَدَى مَشْرِقِيَّةِ رَقِي رَاكِبِ اَلْمَدْرَسَةِ
٤ فَرْجِ مَشْرِقِيَّةِ مَشْرِقِيَّةِ رَقِي رَاكِبِ اَلْمَدْرَسَةِ مَشْرِقِيَّةِ رَقِي رَاكِبِ اَلْمَدْرَسَةِ	لَدَى مَشْرِقِيَّةِ رَقِي رَاكِبِ اَلْمَدْرَسَةِ

වාර්ෂික වාර්තාව: (IUL)166.schol/166/2012/ 20

වාර්ෂික වාර්තාව: 10 වන වාර්ෂික වාර්තාව 2012

2014 - 2013 වාර්ෂික වාර්තාවේ විද්‍යාලීය පාලන කමිටුවේ වාර්ෂික වාර්තාව

වාර්ෂික වාර්තාව	වාර්ෂික වාර්තාව
වාර්ෂික වාර්තාව: වාර්ෂික වාර්තාව	1 වන වාර්ෂික වාර්තාව
<ul style="list-style-type: none"> වාර්ෂික වාර්තාවේ විද්‍යාලීය පාලන කමිටුවේ වාර්ෂික වාර්තාව වාර්ෂික වාර්තාවේ විද්‍යාලීය පාලන කමිටුවේ වාර්ෂික වාර්තාව වාර්ෂික වාර්තාවේ විද්‍යාලීය පාලන කමිටුවේ වාර්ෂික වාර්තාව 	<p>වාර්ෂික වාර්තාව: වාර්ෂික වාර්තාව</p>
<ul style="list-style-type: none"> වාර්ෂික වාර්තාවේ විද්‍යාලීය පාලන කමිටුවේ වාර්ෂික වාර්තාව වාර්ෂික වාර්තාවේ විද්‍යාලීය පාලන කමිටුවේ වාර්ෂික වාර්තාව වාර්ෂික වාර්තාවේ විද්‍යාලීය පාලන කමිටුවේ වාර්ෂික වාර්තාව <p>https://apply.embark.com/student/fulbright/international/</p>	<p>වාර්ෂික වාර්තාව: වාර්ෂික වාර්තාව</p>
<ul style="list-style-type: none"> වාර්ෂික වාර්තාවේ විද්‍යාලීය පාලන කමිටුවේ වාර්ෂික වාර්තාව වාර්ෂික වාර්තාවේ විද්‍යාලීය පාලන කමිටුවේ වාර්ෂික වාර්තාව වාර්ෂික වාර්තාවේ විද්‍යාලීය පාලන කමිටුවේ වාර්ෂික වාර්තාව 	<p>වාර්ෂික වාර්තාව: වාර්ෂික වාර්තාව</p>

<ul style="list-style-type: none"> ■ බැරෑරුම් සහ සෞඛ්‍ය සේවාවන්. ■ සෞඛ්‍ය සේවාවන් සඳහා අවශ්‍ය වන සියලුම සේවාවන් සඳහා අවබෝධයක් ලෙසින් පැහැදිලි කර ඇත. ■ සෞඛ්‍ය සේවාවන් සඳහා අවබෝධයක් ලෙසින් පැහැදිලි කර ඇත. ■ සෞඛ්‍ය සේවාවන් සඳහා අවබෝධයක් ලෙසින් පැහැදිලි කර ඇත. ■ සෞඛ්‍ය සේවාවන් සඳහා අවබෝධයක් ලෙසින් පැහැදිලි කර ඇත. 	
<p>01 ජූනි 2012 (බදාදා) පැවැත්වූ සම්මන්ත්‍රණයේ සාරාංශයක් ලෙසින් පැහැදිලි කර ඇත.</p> <p>පැවැත්වූ 3 වන සම්මන්ත්‍රණයේ (2012) පැවැත්වූ 14:30 ට සම්මන්ත්‍රණයක් සඳහා සහභාගී වීමට අවබෝධයක් ලෙසින් පැහැදිලි කර ඇත.</p>	<p>සම්මන්ත්‍රණය:</p>
<p>www.dhe.gov.mv බැරෑරුම් සහ සෞඛ්‍ය සේවාවන් සඳහා අවබෝධයක් ලෙසින් පැහැදිලි කර ඇත. 3341373 සම්මන්ත්‍රණයක් සඳහා අවබෝධයක් ලෙසින් පැහැදිලි කර ඇත.</p>	<p>අවබෝධයක් ලෙසින් පැහැදිලි කර ඇත:</p>

<p>සෞඛ්‍ය සේවාවන් සඳහා අවබෝධයක් ලෙසින් පැහැදිලි කර ඇත.</p>	<p>සෞඛ්‍ය සේවාවන් සඳහා අවබෝධයක් ලෙසින් පැහැදිලි කර ඇත.</p>
<p>සම්මන්ත්‍රණය: (IUL)166-schol/166/2012/21</p>	<p>15 ජූනි 2012</p>
<p>සෞඛ්‍ය සේවාවන් සඳහා අවබෝධයක් ලෙසින් පැහැදිලි කර ඇත.</p>	
<p>1 වන වරට</p>	<p>සම්මන්ත්‍රණය:</p>
<p>සම්මන්ත්‍රණය: 1 වන වරට</p>	<p>සම්මන්ත්‍රණය:</p>
<ul style="list-style-type: none"> ■ සෞඛ්‍ය සේවාවන් සඳහා අවබෝධයක් ලෙසින් පැහැදිලි කර ඇත. ■ සෞඛ්‍ය සේවාවන් සඳහා අවබෝධයක් ලෙසින් පැහැදිලි කර ඇත. ■ සෞඛ්‍ය සේවාවන් සඳහා අවබෝධයක් ලෙසින් පැහැදිලි කර ඇත. 	<p>සම්මන්ත්‍රණය:</p>

<p>މި ގަވާއިދުގެ ދަށުން ދިވެހިސަރުކާރުގެ ގެޒެޓްގައި ވަނީ ވަނަ ފަޅު އުޅެއްގެ ގޮތުގައި www.dhe.gov.mv ގައި ހުންނަ ބަންދުކުރުމުގެ ޕްލާންގެ ތެރެއިން ޕްލާންތަކާ ގުޅޭގޮތުން ބަންދުކުރުމުގެ ގޮތުގައި ބަނޑު ލިބިވާނެ ގޮތަށް ހަދާފައި ވާނެއެވެ.</p> <p>■ ގަވާއިދުގެ ދަށުން ދިވެހިސަރުކާރުގެ ގެޒެޓްގައި ވަނީ ވަނަ ފަޅު އުޅެއްގެ ގޮތުގައި www.dhe.gov.mv ގައި ހުންނަ ބަންދުކުރުމުގެ ޕްލާންގެ ތެރެއިން ޕްލާންތަކާ ގުޅޭގޮތުން ބަންދުކުރުމުގެ ގޮތުގައި ބަނޑު ލިބިވާނެ ގޮތަށް ހަދާފައި ވާނެއެވެ.</p>	
<ul style="list-style-type: none">■ ބަނޑު ލިބިވާނެ ގޮތަށް ހަދާނީ ފިޔަވަހުގެ ފަންނުގެ ތެރެއިންނެވެ.■ ފަންނުގެ ތެރެއިން ބަނޑު ލިބިވާނެ ގޮތަށް ހަދާނީ ފިޔަވަހުގެ ފަންނުގެ ތެރެއިންނެވެ.■ ބަނޑު ލިބިވާނެ ގޮތަށް ހަދާނީ ފިޔަވަހުގެ ފަންނުގެ ތެރެއިންނެވެ.■ ބަނޑު ލިބިވާނެ ގޮތަށް ހަދާނީ ފިޔަވަހުގެ ފަންނުގެ ތެރެއިންނެވެ.■ ބަނޑު ލިބިވާނެ ގޮތަށް ހަދާނީ ފިޔަވަހުގެ ފަންނުގެ ތެރެއިންނެވެ.■ ބަނޑު ލިބިވާނެ ގޮތަށް ހަދާނީ ފިޔަވަހުގެ ފަންނުގެ ތެރެއިންނެވެ.	<p>ދަނޑު ލިބިވާނެ ގޮތަށް ހަދާނީ ފިޔަވަހުގެ ފަންނުގެ ތެރެއިންނެވެ.</p>
<p>ސަބްޖެކެއްގެ ގޮތުގައި 03 ޖެޕްރަޕްރި 2012 (ހަސަބަލީ) ގަވާއިދުގެ 14:30 ގައި ނިންމައި ގަވާއިދުގެ ތެރެއިން ބަނޑު ލިބިވާނެ ގޮތަށް ހަދާނީ ފިޔަވަހުގެ ފަންނުގެ ތެރެއިންނެވެ.</p>	
<p>ނިންމައިވާ ގޮތަށް ހަދާނީ ފިޔަވަހުގެ ފަންނުގެ ތެރެއިންނެވެ. 15:00 ގައި ނިންމައި ގަވާއިދުގެ 8 ވަނަ ފަންނުގެ ތެރެއިން ބަނޑު ލިބިވާނެ ގޮތަށް ހަދާނީ ފިޔަވަހުގެ ފަންނުގެ ތެރެއިންނެވެ.</p> <p>http://www.dhe.gov.mv (http://www.dhe.gov.mv) ގައި ބަނޑު ލިބިވާނެ ގޮތަށް ހަދާނީ ފިޔަވަހުގެ ފަންނުގެ ތެރެއިންނެވެ.</p> <p>3341373 ނަންބަރު ފަންނުގައި ބަނޑު ލިބިވާނެ ގޮތަށް ހަދާނީ ފިޔަވަހުގެ ފަންނުގެ ތެރެއިންނެވެ.</p>	

سولاسیون سیکورٹی ڈیپارٹمنٹ

۱۷ جون ۲۰۱۲ء کو جاری کیے گئے ہیں۔
 ڈیپارٹمنٹ کے ایجنسی کے ذریعے
 ڈیپارٹمنٹ کے ایجنسی کے ذریعے۔

سولاسیون: 17 جون 2012 | سولاسیون نمبر: (IUL)166-Schol/166/2012/28

سولاسیون کے ذریعے ایجنسی کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے

سولاسیون نمبر	سولاسیون کے ذریعے	12	سولاسیون کے ذریعے	سولاسیون کے ذریعے
	* Aviation Operations (2) * Mechatronics Engineering (1) * Aircraft Maintenance Engineering (1) * Software Engineering (1) * Computing with specialism in Multimedia (1) * Business Administration (1) * Marketing (1) * Accounting and Finance (1) * Secondary Teaching (1) * Special Education (1) * Pharmacy (1)			سولاسیون کے ذریعے

سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے

■ سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے

■ سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے

■ سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے

سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے

IELTS 550 اور TOEFL 6.0 اور سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے

سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے

سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے

■ سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے

■ سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے

■ سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے

سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے

IELTS 550 اور TOEFL 6.0 اور سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے

سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے سولاسیون کے ذریعے

سولاسیون سہولت کے تحت

درستی کے ساتھ، اس وقت کے سہولت کے تحت

سہولت کے تحت: (IUL)166-Schol/166/2012/30

17 مارچ 2012

گورنمنٹ آف ایجوکیشن کے تحت، ریگولیشن آف ایجوکیشن کے تحت، 2012

لاڈی کے تحت: II کے تحت، ریگولیشن آف ایجوکیشن کے تحت، گورنمنٹ آف ایجوکیشن کے تحت

تاریخ: 17 مارچ 2012

تاریخ: 17 مارچ 2012

لاڈی کے تحت: ریگولیشن آف ایجوکیشن کے تحت، گورنمنٹ آف ایجوکیشن کے تحت، 03 مارچ 2012

تاریخ: 17 مارچ 2012

تاریخ: 17 مارچ 2012

لاڈی کے تحت: ریگولیشن آف ایجوکیشن کے تحت، گورنمنٹ آف ایجوکیشن کے تحت، 02 مارچ 2012

تاریخ: 17 مارچ 2012

تاریخ: 17 مارچ 2012

<p>නියෝජිතයන් සඳහා ඡන්ද කොටසක් තිබේද නැද්ද</p>	<p>නියෝජිතයන්</p>	<p>දිනය</p>	<p>මාර්ගගත</p>
<p> <ul style="list-style-type: none"> ■ රජයේ සේවයේ නියුතු වෛද්‍යවරුන්ට වෛද්‍ය ආපදා ක්‍රියාත්මක කිරීමේදී සහභාගී වීමට ඉඩ හැරීම. ■ වෛද්‍ය සේවයේ නියුතු වෛද්‍යවරුන්ට වෛද්‍ය ආපදා ක්‍රියාත්මක කිරීමේදී සහභාගී වීමට ඉඩ හැරීම. </p>	<p>වෛද්‍ය සේවයේ නියුතු වෛද්‍යවරුන්</p>	<p>2012 ජූනි 14</p>	<p>වෛද්‍ය සේවයේ නියුතු වෛද්‍යවරුන්</p>
<p> <ul style="list-style-type: none"> ■ වෛද්‍ය සේවයේ නියුතු වෛද්‍යවරුන්ට වෛද්‍ය ආපදා ක්‍රියාත්මක කිරීමේදී සහභාගී වීමට ඉඩ හැරීම. ■ වෛද්‍ය සේවයේ නියුතු වෛද්‍යවරුන්ට වෛද්‍ය ආපදා ක්‍රියාත්මක කිරීමේදී සහභාගී වීමට ඉඩ හැරීම. </p>	<p>වෛද්‍ය සේවයේ නියුතු වෛද්‍යවරුන්</p>	<p>2012 ජූනි 14</p>	<p>වෛද්‍ය සේවයේ නියුතු වෛද්‍යවරුන්</p>
<p> <ul style="list-style-type: none"> ■ වෛද්‍ය සේවයේ නියුතු වෛද්‍යවරුන්ට වෛද්‍ය ආපදා ක්‍රියාත්මක කිරීමේදී සහභාගී වීමට ඉඩ හැරීම. ■ වෛද්‍ය සේවයේ නියුතු වෛද්‍යවරුන්ට වෛද්‍ය ආපදා ක්‍රියාත්මක කිරීමේදී සහභාගී වීමට ඉඩ හැරීම. </p>	<p>වෛද්‍ය සේවයේ නියුතු වෛද්‍යවරුන්</p>	<p>2012 ජූනි 14</p>	<p>වෛද්‍ය සේවයේ නියුතු වෛද්‍යවරුන්</p>

- 2012 ރަජިސްޓްރޭޝަން އޮފީހުގެ ބޭނުންތަކާ ގުޅިގެން 2012 ރަජިސްޓްރޭޝަން އޮފީހުގެ ބޭނުންތަކާ ގުޅިގެން 2012 ރަජިސްޓްރޭޝަން އޮފީހުގެ ބޭނުންތަކާ ގުޅިގެން 2012 ރަජިސްޓްރޭޝަން އޮފީހުގެ ބޭނުންތަކާ ގުޅިގެން 2012 ރަජިސްޓްރޭޝަން އޮފީހުގެ ބޭނުންތަކާ ގުޅިގެން
- 2012 ރަජިސްޓްރޭޝަން އޮފީހުގެ ބޭނުންތަކާ ގުޅިގެން 2012 ރަජިސްޓްރޭޝަން އޮފީހުގެ ބޭނުންތަކާ ގުޅިގެން 2012 ރަජިސްޓްރޭޝަން އޮފީހުގެ ބޭނުންތަކާ ގުޅިގެން 2012 ރަජިސްޓްރޭޝަން އޮފީހުގެ ބޭނުންތަކާ ގުޅިގެން 2012 ރަජިސްޓްރޭޝަން އޮފީހުގެ ބޭނުންތަކާ ގުޅިގެން
- 2012 ރަජިސްޓްރޭޝަން އޮފީހުގެ ބޭނުންތަކާ ގުޅިގެން 2012 ރަජިސްޓްރޭޝަން އޮފީހުގެ ބޭނުންތަކާ ގުޅިގެން 2012 ރަජިސްޓްރޭޝަން އޮފީހުގެ ބޭނުންތަކާ ގުޅިގެން 2012 ރަජިސްޓްރޭޝަން އޮފީހުގެ ބޭނުންތަކާ ގުޅިގެން 2012 ރަજިސްޓްރޭޝަން އޮފީހުގެ ބޭނުންތަކާ ގުޅިގެން

ސަރުކާރުގެ ފަރާތުން 2012 ޖުލައި 21 ވަނަ ދުވަހު (ބަންދު ދުވަހު) ރަވަނީ 14:30 ގައެވެ. ސަރުކާރުގެ ފަރާތުން 2012 ޖުލައި 21 ވަނަ ދުވަހު (ބަންދު ދުވަހު) ރަވަނީ 14:30 ގައެވެ. ސަރުކާރުގެ ފަރާތުން 2012 ޖުލައި 21 ވަނަ ދުވަހު (ބަންދު ދުވަހު) ރަވަނީ 14:30 ގައެވެ.

3341371 / 3341376 / 3341388 / 3341381 : ފޮނުވާ ނުވަތަ ފޮނުވަންޖެހޭ ތަޢާލީމީ ސަރުކާރުގެ ފަރާތުން
 3341385 : ފޯމް ފޮނުވާ ނުވަތަ ފޮނުވަންޖެހޭ ތަޢާލީމީ ސަރުކާރުގެ ފަރާތުން
 admin@dhe.gov.mv : ފޯމް ފޮނުވާ ނުވަތަ ފޮނުވަންޖެހޭ ތަޢާލީމީ ސަރުކާރުގެ ފަރާތުން

ސަރުކާރުގެ ފަރާތުން

ސަރުކާރުގެ ފަރާތުން 2012 ޖުލައި 21 ވަނަ ދުވަހު (ބަންދު ދުވަހު) ރަވަނީ 14:30 ގައެވެ. ސަރުކާރުގެ ފަރާތުން 2012 ޖުލައި 21 ވަނަ ދުވަހު (ބަންދު ދުވަހު) ރަވަނީ 14:30 ގައެވެ. ސަރުކާރުގެ ފަރާތުން 2012 ޖުލައި 21 ވަނަ ދުވަހު (ބަންދު ދުވަހު) ރަވަނީ 14:30 ގައެވެ.

69-RA/IL/2012/17 : ސަރުކާރުގެ ފަރާތުން

ހުށަހަޅާ ފަރާތުން

ރަޖިސްޓްރޭޝަން އޮފީހުގެ ބޭނުންތަކާ ގުޅިގެން 2012 ޖުލައި 23 ވަނަ ދުވަހު (ބަންދު ދުވަހު) ރަވަނީ 14:30 ގައެވެ. ސަރުކާރުގެ ފަރާތުން 2012 ޖުލައި 23 ވަނަ ދުވަހު (ބަންދު ދުވަހު) ރަވަނީ 14:30 ގައެވެ. ސަރުކާރުގެ ފަރާތުން 2012 ޖުލައި 23 ވަނަ ދުވަހު (ބަންދު ދުވަހު) ރަވަނީ 14:30 ގައެވެ.

1: ފޯމް ފޮނުވާ ނުވަތަ ފޮނުވަންޖެހޭ ތަޢާލީމީ ސަރުކާރުގެ ފަރާތުން

• ފޯމް ފޮނުވާ ނުވަތަ ފޮނުވަންޖެހޭ ތަޢާލީމީ ސަރުކާރުގެ ފަރާތުން 9.2 ވަނަ ދުވަހު

دوه بېړۍ په پورتني کورني لارونو کې ليدل شوي دي چې د دې لارونو پر سر...

دوه بېړۍ پر لار کې...

سرنوټونه: MTCC-LOD/IU/2012/92

د بېړۍ

03 د جون 2012 و او د لارونو پر سر د بېړۍ د بېړۍ کورني لارونو کې ليدل شوي دي چې د دې لارونو پر سر...

1. د بېړۍ کورني لارونو کې ليدل شوي دي چې د دې لارونو پر سر...

د بېړۍ کورني لارونو کې ليدل شوي دي چې د دې لارونو پر سر...

د بېړۍ کورني لارونو کې ليدل شوي دي چې د دې لارونو پر سر...

د بېړۍ کورني لارونو کې ليدل شوي دي چې د دې لارونو پر سر...

3317070 او 3001480 سرنومونه د دې لارونو پر سر...

سرنوټونه د دې لارونو پر سر...

01 مخه 1433

24 د جون 2012

دوه بېړۍ په پورتني کورني لارونو کې ليدل شوي دي چې د دې لارونو پر سر...

دوه بېړۍ پر لار کې...

سرنوټونه: MTCC-LOD/IU/2012/91

د بېړۍ

29 د جون 2012 و او د لارونو پر سر د بېړۍ د بېړۍ کورني لارونو کې ليدل شوي دي چې د دې لارونو پر سر...

1. د بېړۍ کورني لارونو کې ليدل شوي دي چې د دې لارونو پر سر...

د بېړۍ کورني لارونو کې ليدل شوي دي چې د دې لارونو پر سر...

د بېړۍ کورني لارونو کې ليدل شوي دي چې د دې لارونو پر سر...

د بېړۍ کورني لارونو کې ليدل شوي دي چې د دې لارونو پر سر...

3317070 او 3001480 سرنومونه د دې لارونو پر سر...

سرنوټونه د دې لارونو پر سر...

01 مخه 1433

24 د جون 2012

سرنوټونه: ADM-MPL/2012/73

د بېړۍ

دوه بېړۍ په پورتني کورني لارونو کې ليدل شوي دي چې د دې لارونو پر سر...

دوه بېړۍ پر لار کې...

د بېړۍ کورني لارونو کې ليدل شوي دي چې د دې لارونو پر سر...

د بېړۍ کورني لارونو کې ليدل شوي دي چې د دې لارونو پر سر...

د بېړۍ کورني لارونو کې ليدل شوي دي چې د دې لارونو پر سر...

د بېړۍ کورني لارونو کې ليدل شوي دي چې د دې لارونو پر سر...

د بېړۍ کورني لارونو کې ليدل شوي دي چې د دې لارونو پر سر...

03 مخه 1433

24 د جون 2012

די שפראך פון אונז
דאָס פּראָצעדור.

סרטיבל: (IUL)23-AP/1/2012/112

אויספיר

דער צווייטער טאג פון די שפראך פון אונז איז געווען די 17טן יולי 2012. די שפראך פון אונז איז געווען די 17טן יולי 2012. די שפראך פון אונז איז געווען די 17טן יולי 2012.

די שפראך פון אונז איז געווען די 17טן יולי 2012. די שפראך פון אונז איז געווען די 17טן יולי 2012. די שפראך פון אונז איז געווען די 17טן יולי 2012.

17 יולי 2012

08 יולי 2012

די שפראך פון אונז
דאָס פּראָצעדור.

סרטיבל: (IUL)23-AP/1/2012/118

אויספיר

די שפראך פון אונז איז געווען די 17טן יולי 2012. די שפראך פון אונז איז געווען די 17טן יולי 2012. די שפראך פון אונז איז געווען די 17טן יולי 2012.

די שפראך פון אונז איז געווען די 17טן יולי 2012. די שפראך פון אונז איז געווען די 17טן יולי 2012. די שפראך פון אונז איז געווען די 17טן יולי 2012.

די שפראך פון אונז איז געווען די 17טן יולי 2012. די שפראך פון אונז איז געווען די 17טן יולי 2012. די שפראך פון אונז איז געווען די 17טן יולי 2012.

24 יולי 2012

15 יולי 2012

ދިވެހިސަރުކާރުގެ ގެޒެޓްކުރުމުގެ އޮފީހުގެ މަސައްކަތުގައި
- ސަރުކާރުގެ ފަރާތުން ދިވެހިސަރުކާރުގެ ގެޒެޓްކުރުމުގެ އޮފީހުގެ މަސައްކަތުގައި
ސަރުކާރުގެ ފަރާތުން ދިވެހިސަރުކާރުގެ ގެޒެޓްކުރުމުގެ އޮފީހުގެ މަސައްކަތުގައި

އިތުރު މަޢުލޫމާތު ހޯއްދެވުމަށް ލިޔެ އިއްވުމަށް ފަރާތުން ދިވެހިސަރުކާރުގެ ގެޒެޓްކުރުމުގެ އޮފީހުގެ މަސައްކަތުގައި
މަސައްކަތް ކުރުމަށް ފަރާތުން ދިވެހިސަރުކާރުގެ ގެޒެޓްކުރުމުގެ އޮފީހުގެ މަސައްކަތުގައި
ފީލްޑް އޮފީހުގެ މަސައްކަތުގައި fieldoffice@maldivesgcc.com ގައި ފޯމް ފުރިހަމަކުރުމަށް އިތުރު މަޢުލޫމާތު
ދަންނަވަންދެއެވެ.

ހުޅުވާލެވިފައިވާ ސަރުކާރުގެ ފަރާތުން ދިވެހިސަރުކާރުގެ ގެޒެޓްކުރުމުގެ އޮފީހުގެ މަސައްކަތުގައި
31 ޖުލައި 2012 ގައި ހުޅުވާލެވިފައިވާ ސަރުކާރުގެ ފަރާތުން ދިވެހިސަރުކާރުގެ ގެޒެޓްކުރުމުގެ އޮފީހުގެ މަސައްކަތުގައި
20 ޖުލައި 2012

Ministry of Housing and Environment
Male’, Republic of Maldives

Annual Program Statement – Lh. Hinnavaru and HA. Dhidhdhoo

The Enhance Climate Resiliency and Water Security in the Maldives Project (Maldives GCC), funded by the United States Agency for International Development (USAID), is intended to demonstrate the process and outcomes needed to allow island communities to maximize their opportunity to overcome impacts from global climate change.

To achieve this goal, Maldives GCC is seeking applications for grants from a variety of NGOs and registered community organizations to work with Hinnavaru and Dhidhdhoo Island residents to demonstrate improved environmental management and natural resource conservation. Project activities focus on enhancing integrated water resources management – rainwater, groundwater and desalinated water – and improving management of solid waste. Therefore proposed grant activities should focus in these areas.

Maldives GCC intends to fund small grants over the next three years to organizations located on, or working with, Hinnavaru and Dhidhdhoo islands. It is expected that the maximum amount of per grant will not exceed \$US 5,000 (MVR 77,000). Activities should be geographically limited to these two islands.

Maldives GCC is interested in creative approaches to meet the objectives listed above that could include, but are not limited to:

- Communication and awareness campaigns that support behavior changes and/or provide information and build capacity of communities to strengthen their environment and natural resources management capacity and resiliency to the impacts of climate change.
- Develop, test, and market innovative approaches and solutions to address water supply, sewerage, solid waste, renewable energy, or related natural resource and environmental issues.
- Research, workshops, seminars, and/or technical services that augment project activities.

For more information on eligibility and program requirements, please email: fieldoffice@maldivesgcc.com for an application packet and instructions after the 1st June 2012. Applications will be reviewed in the order that they are received, to December 31, 2012.

ދިވެހިސަރުކާރުގެ ގެޒެޓްގައި ވަނީ ބަޔާންކޮށްފައިވާ ގޮތުގައި
 ސަރުކާރުގެ ގެޒެޓްގައި ވަނީ ބަޔާންކޮށްފައިވާ ގޮތުގައި

ސަރުކާރުގެ ގެޒެޓްގައި (IUL)101-BR/1/2012/52

ނަންބަރު

މި ސަރުކާރުގެ ގެޒެޓްގައި ވަނީ ބަޔާންކޮށްފައިވާ ގޮތުގައި
 (KICHU'S PRIVATE LIMITED) ނަންބަރު: C-0531/2011 ގެ ސަރުކާރުގެ ގެޒެޓްގައި 2012 ވަނަ ދަަނީ
 (LIMITED) ނަންބަރު: "ގްލޯބަލް ޓެލެންޓް މާލްދިވެހިސަރުކާރުގެ ގެޒެޓްގައި" (GLOBAL TALENT MALDIVES PRIVATE)
 ނަންބަރު: ވަނަ ދަަނީ ބަޔާންކޮށްފައިވާ ގޮތުގައި.

މި ނަންބަރުގެ ދަށުން ބަޔާންކޮށްފައިވާ ގޮތުގައި.

26 ނަންބަރުގެ ދަށުން 1433
 17 ނަންބަރުގެ ދަށުން 2012

މި ސަރުކާރުގެ ގެޒެޓްގައި ވަނީ ބަޔާންކޮށްފައިވާ ގޮތުގައި
 ސަރުކާރުގެ ގެޒެޓްގައި ވަނީ ބަޔާންކޮށްފައިވާ ގޮތުގައި

ސަރުކާރުގެ ގެޒެޓްގައި (IUL)427-BUR/1/2012/26

ނަންބަރު

މި ސަރުކާރުގެ ގެޒެޓްގައި ވަނީ ބަޔާންކޮށްފައިވާ ގޮތުގައި 24 ވަނަ ދަަނީ (ނ) ޓީސީސީސީ ސަރުކާރުގެ ގެޒެޓްގައި
 ސަރުކާރުގެ ގެޒެޓްގައި ވަނީ ބަޔާންކޮށްފައިވާ ގޮތުގައި 12 ނަންބަރުގެ ދަށުން
 2012 ގެ ސަރުކާރުގެ ގެޒެޓްގައި ވަނީ ބަޔާންކޮށްފައިވާ ގޮތުގައި ނަންބަރު: ވަނަ ދަަނީ ބަޔާންކޮށްފައި
 ވަނަ ދަ_aނީ ބަޔާންކޮށްފައިވާ ގޮތުގައި ނަންބަރު: ވަނަ ދަ_aނީ ބަޔާންކޮށްފައިވާ ގޮތުގައި
 ނަންބަރު: ވަނަ ދަ_aނީ ބަޔާންކޮށްފައިވާ ގޮތުގައި ނަންބަރު: ވަނަ ދ_aނީ ބަޔާންކޮށްފައިވާ ގޮތުގައި
 ނަންބަރު: ވަނަ ދ_aނީ ބަޔާންކޮށްފައިވާ ގޮތުގައި ނަންބަރު: ވަނަ ދ_aނީ ބަޔާންކޮށްފައިވާ ގޮތުގައި
 ނަންބަރު: ވަނަ ދ_aނީ ބަޔާންކޮށްފައިވާ ގޮތުގައި ނަންބަރު: ވަނަ ދ_aނީ ބަޔާންކޮށްފައިވާ ގޮތުގައި

ނަންބަރު: ވަނަ ދ_aނީ ބަޔާންކޮށްފައިވާ ގޮތުގައި ނަންބަރު: ވަނަ ދ_aނީ ބަޔާންކޮށްފައިވާ ގޮތުގައި
 ނަންބަރު: ވަނަ ދ_aނީ ބަޔާންކޮށްފައިވާ ގޮތުގައި ނަންބަރު: ވަނަ ދ_aނީ ބަޔާންކޮށްފައިވާ ގޮތުގައި
 ނަންބަރު: ވަނަ ދ_aނީ ބަޔާންކޮށްފައިވާ ގޮތުގައި ނަންބަރު: ވަނަ ދ_aނީ ބަޔާންކޮށްފައިވާ ގޮތުގައި
 ނަންބަރު: ވަނަ ދ_aނީ ބަޔާންކޮށްފައިވާ ގޮތުގައި ނަންބަރު: ވަނަ ދ_aނީ ބަޔާންކޮށްފައިވާ ގޮތުގައި
 ނަންބަރު: ވަނަ ދ_aނީ ބަޔާންކޮށްފައިވާ ގޮތުގައި ނަންބަރު: ވަނަ ދ_aނީ ބަޔާންކޮށްފައިވާ ގޮތުގައި

26 ނަންބަރުގެ ދަށުން 1433
 17 ނަންބަރުގެ ދަށުން 2012

ד"ר יעקב נאדלסטיין

ד"ר יעקב נאדלסטיין

סרטון: (IUL)425-1A/1/2012/96

התשובה

התשובה על שאלתך מתייחסת לשינוי המצב ולמציאת פתרון לבעיה שאתה מתמודד איתה.

התשובה על שאלתך מתייחסת לשינוי המצב ולמציאת פתרון לבעיה שאתה מתמודד איתה. (התשובה מתייחסת לשינוי המצב ולמציאת פתרון לבעיה שאתה מתמודד איתה.)

ודג, התשובה על שאלתך מתייחסת לשינוי המצב ולמציאת פתרון לבעיה שאתה מתמודד איתה. התשובה על שאלתך מתייחסת לשינוי המצב ולמציאת פתרון לבעיה שאתה מתמודד איתה. ד"ר יעקב נאדלסטיין

24 עמודים 1433

15 יולי 2012

ד"ר יעקב נאדלסטיין

ד"ר יעקב נאדלסטיין

סרטון: (IUL)425-A1/1/2012/92

התשובה

התשובה על שאלתך מתייחסת לשינוי המצב ולמציאת פתרון לבעיה שאתה מתמודד איתה.

התשובה על שאלתך מתייחסת לשינוי המצב ולמציאת פתרון לבעיה שאתה מתמודד איתה.

התשובה על שאלתך מתייחסת לשינוי המצב ולמציאת פתרון לבעיה שאתה מתמודד איתה. התשובה על שאלתך מתייחסת לשינוי המצב ולמציאת פתרון לבעיה שאתה מתמודד איתה.

התשובה על שאלתך מתייחסת לשינוי המצב ולמציאת פתרון לבעיה שאתה מתמודד איתה. (11/2010) 13 וסר דאקטרי (ר) ירושלים תשס"ב, המפרט את השינויים המצויים בתקנות המס, המפרט את השינויים המצויים בתקנות המס, המפרט את השינויים המצויים בתקנות המס.

ודג, התשובה על שאלתך מתייחסת לשינוי המצב ולמציאת פתרון לבעיה שאתה מתמודד איתה. התשובה על שאלתך מתייחסת לשינוי המצב ולמציאת פתרון לבעיה שאתה מתמודד איתה.

17 עמודים 1433

08 יולי 2012

دغه وټه څيړنه وکړه
دغه ترڅو څيړنه وکړه

سره سمه: 113-CCD/I-2012/64

اړخونه

څيړنه د څيړنې لاندې وکړه دغه وټه څيړنه د څيړنې لاندې وکړه د څيړنې لاندې وکړه
دغه وټه څيړنه د څيړنې لاندې وکړه د څيړنې لاندې وکړه د څيړنې لاندې وکړه
دغه وټه څيړنه د څيړنې لاندې وکړه د څيړنې لاندې وکړه د څيړنې لاندې وکړه
دغه وټه څيړنه د څيړنې لاندې وکړه د څيړنې لاندې وکړه د څيړنې لاندې وکړه

موندنه	موندنه	دغه	دغه	دغه
څيړنه د څيړنې لاندې وکړه (QDE25-010207)	01	دغه وټه څيړنه د څيړنې لاندې وکړه (څيړنه وکړه) دغه وټه څيړنه د څيړنې لاندې وکړه	13-09-2012	دغه وټه څيړنه د څيړنې لاندې وکړه
څيړنه د څيړنې لاندې وکړه (DE3FS-255503)	01	دغه وټه څيړنه د څيړنې لاندې وکړه (څيړنه وکړه) دغه وټه څيړنه د څيړنې لاندې وکړه APHU 716 6900	19-01-2012	دغه وټه څيړنه د څيړنې لاندې وکړه
څيړنه د څيړنې لاندې وکړه (WBAVH6030NK93758)	01	دغه وټه څيړنه د څيړنې لاندې وکړه (څيړنه وکړه) دغه وټه څيړنه د څيړنې لاندې وکړه APHU 716 6900	19-01-2012	دغه وټه څيړنه د څيړنې لاندې وکړه

01 مخه 1433
22 څيړنه 2012

څيړنه د څيړنې لاندې وکړه د څيړنې لاندې وکړه د څيړنې لاندې وکړه
دغه وټه څيړنه د څيړنې لاندې وکړه د څيړنې لاندې وکړه د څيړنې لاندې وکړه
دغه وټه څيړنه د څيړنې لاندې وکړه د څيړنې لاندې وکړه د څيړنې لاندې وکړه

دغه وټه څيړنه د څيړنې لاندې وکړه
دغه ترڅو څيړنه وکړه

سره سمه: 145-L/2012/33

اړخونه

دغه وټه څيړنه د څيړنې لاندې وکړه د څيړنې لاندې وکړه د څيړنې لاندې وکړه
دغه وټه څيړنه د څيړنې لاندې وکړه د څيړنې لاندې وکړه د څيړنې لاندې وکړه
دغه وټه څيړنه د څيړنې لاندې وکړه د څيړنې لاندې وکړه د څيړنې لاندې وکړه

29 دغه وټه څيړنه د څيړنې لاندې وکړه 1433
20 څيړنه 2012

ڏوھ ڏيکاري ڏيکاري ڏيکاري
 ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري
 ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري

سڙو سڙو: (IUL)138/1/2012/32

ڏيکاري

”ڏيکاري ڏيکاري“ ۽ ڏيکاري ڏيکاري ” ا “ لاءِ ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري
 ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري
 ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري
 ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري
 ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري ڏيکاري

ڏيکاري	ڏيکاري	ڏيکاري	ڏيکاري	ڏيکاري	ڏيکاري
سڙو سڙو	سڙو سڙو	سڙو سڙو	سڙو سڙو	سڙو سڙو	سڙو سڙو
A000191	55	A000730	28	A000991	1
A000729	56	A000952	29	A000900	2
A000212	57	A001109	30	A000237	3
A000211	58	A001213	31	A001014	4
A000318	59	A000776	32	A000821	5
A000975	60	A000891	33	A000660	6
A000419	61	A000223	34	A000610	7
A001211	62	A000788	35	A000754	8
A000104	63	A000142	36	A000042	9
A000520	64	A000495	37	A000214	10
A001001	65	A000059	38	A000198	11
A000633	66	A000699	39	A000096	12
A000541	67	A000996	40	A001092	13
A000354	68	A001054	41	A001120	14
A000614	69	A000500	42	A000204	15
A000400	70	A000119	43	A000634	16
A000051	71	A000632	44	A001163	17
A001089	72	A000514	45	A000925	18
A000139	73	A000100	46	A000340	19
A000883	74	A000479	47	A000071	20
A000301	75	A000321	48	A000243	21
A001080	76	A000463	49	A001217	22
A000487	77	A000759	50	A000295	23
A000291	78	A000062	51	A000920	24
A000197	79	A000442	52	A000272	25
A001123	80	A000347	53	A000559	26
A001173	81	A000300	54	A001030	27

קוד	מספר עמוד
A000481	116
A000249	117
A000248	118
A000269	119
A000735	120
A000938	121
A000940	122
A001228	123
A000644	124
A000401	125
A000081	126
A000282	127
A000666	128
A001166	129
A000580	130
A000255	131
A000373	132

קוד	מספר עמוד
A001066	99
A000931	100
A000535	101
A000536	102
A000274	103
A000467	104
A001081	105
A000534	106
A000537	107
A001009	108
A000854	109
A000084	110
A000986	111
A000055	112
A000643	113
A001222	114
A001160	115

קוד	מספר עמוד
A000076	82
A000133	83
A000188	84
A000114	85
A000937	86
A000068	87
A000387	88
A000837	89
A000842	90
A000488	91
A000213	92
A000257	93
A000260	94
A000258	95
A000105	96
A000761	97
A001064	98

המסמכים המוצגים הם מסמכים שהוגשו לרשות המבחנת, והם אינם בהכרח מסמכים שהוגשו לרשות המבחנת.

1. המסמכים המוצגים הם מסמכים שהוגשו לרשות המבחנת, והם אינם בהכרח מסמכים שהוגשו לרשות המבחנת.
2. המסמכים המוצגים הם מסמכים שהוגשו לרשות המבחנת, והם אינם בהכרח מסמכים שהוגשו לרשות המבחנת.
3. המסמכים המוצגים הם מסמכים שהוגשו לרשות המבחנת, והם אינם בהכרח מסמכים שהוגשו לרשות המבחנת.
4. המסמכים המוצגים הם מסמכים שהוגשו לרשות המבחנת, והם אינם בהכרח מסמכים שהוגשו לרשות המבחנת.

1. המסמכים המוצגים הם מסמכים שהוגשו לרשות המבחנת, והם אינם בהכרח מסמכים שהוגשו לרשות המבחנת.
 2. המסמכים המוצגים הם מסמכים שהוגשו לרשות המבחנת, והם אינם בהכרח מסמכים שהוגשו לרשות המבחנת.
- המסמכים המוצגים הם מסמכים שהוגשו לרשות המבחנת, והם אינם בהכרח מסמכים שהוגשו לרשות המבחנת.

MALDIVES INLAND REVENUE AUTHORITY

Malé, Republic of Maldives

TAX RULING

Business Profit Tax: Withholding tax and income subject to business profit tax

Reference No.: TR-2012/B9

Date of issue: Tuesday, 22 May 2012

This ruling is issued pursuant to the authority granted under section 84 of the Tax Administration Act (Law Number 3/2010) as amended by Law Number 14/2011. Unless otherwise stated, all legislative references are to the Business Profit Tax Act (Law Number 5/2011). This ruling is legally binding.

Introduction

1. This ruling explains the business profit tax treatment of accrued income which is subject to business profit tax and withholding tax.
2. This ruling also explains the circumstance where a non-resident is not required to deduct withholding tax from payments made to other non-residents.
3. This ruling further explains the business profit tax treatment of expenses incurred by a non-resident Person that derives amounts subject to withholding tax.

Ruling

Accrued income subject to withholding tax

4. Where—
 - (a) A non-resident Person is liable to tax in the Maldives under Section 3(c) of the Act; and
 - (b) The profits for an accounting period include an amount of accrued income, which will be subject to withholding tax under section 6 of the Act when it is paid to the Person after the end of the accounting period in which the amount is accrued; and
 - (c) A written contract between that Person and the payer of the accrued amount specifies that the amount of the payment is to be calculated by reference to revenue, expenditure, or profits of the payer; and
 - (d) The amount is paid to the Person within five (5) months from the end of the accounting period in which it is accrued; and
 - (e) The correct amount of withholding tax is deducted from the gross amount of the payment at the time that it is paid to the Person; and
 - (f) The amount of withholding tax referred to in paragraph 4(e) of this ruling is paid to the MIRA in accordance with section 25 of the Act, a deduction may be made for the amount so accrued in the financial statements for the accounting period in the calculation of the taxable profits of the Person for that period.
5. Notwithstanding paragraph 4 of this ruling, any amount paid on account of an accrued amount before the end of the accounting period in which the accrual referred to in paragraph 4 occurs shall be subject to withholding tax under section 6 of the Act.

Withholding tax on amounts paid to non-resident Persons

6. Where—
 - (a) a non-resident Person (Non-resident 1) has received income in respect of which the payer has paid the correct amount of withholding tax to the MIRA under sections 6 and 25 of the Act; and
 - (b) Non-resident 1 pays the whole or part of that income to another non-resident Person (Non-resident 2); and
 - (c) the payment referred to in paragraph 6(b) would, but for this ruling, be subject to withholding tax, Non-resident 1 is not required to deduct withholding tax from the payment to Non-resident 2.
7. Where—
 - (a) paragraphs 6(a) and 6(b) of this ruling apply; and
 - (b) Non-resident 1 also derives income that is not subject to withholding tax, any payment made by Non-resident 1 to Non-resident 2 shall be deemed to be paid first from the income that

1. 2. 3. 4. 5. 6. 7. 8.

37. 38.

1. 2.

1. 2.

1. 2.

1. 2.

1. 2.

1. 2.

1. 2. 3.

1. 2. 3. 4. 5. 6.

1. 2. 3. 4. 5. 6. 7. 8.

1. 2. 3. 4. 5. 6. 7. 8.

1. 2. 3. 4. 5. 6. 7. 8.

1. 2. 3. 4. 5. 6. 7. 8.

1. 2. 3. 4. 5. 6. 7. 8.

9. 10.

11. 12.

13. 14.

15. 16.

17. 18.

19. 20.

21. 22. 23. 24. 25. 26. 27. 28. 29. 30.

31. 32. 33. 34. 35. 36. 37. 38. 39. 40.

41. 42. 43. 44. 45. 46. 47. 48. 49. 50.

«در سبب مجازات کیفری از سوی هیئت منصفه کیفری»

سید علی حسینی، دکترا، استادیار حقوق کیفری، دانشگاه تهران

در سبب مجازات کیفری از سوی هیئت منصفه کیفری، موضوع مجازات کیفری از سوی هیئت منصفه کیفری، یکی از مباحث مهم و حساس در نظام حقوق کیفری است. در این مقاله، به بررسی مبانی حقوقی و فلسفی مجازات کیفری از سوی هیئت منصفه کیفری پرداخته می‌شود. همچنین، به بررسی چالش‌ها و راهکارهای موجود در این زمینه پرداخته می‌شود.

در سبب مجازات کیفری از سوی هیئت منصفه کیفری، یکی از مباحث مهم و حساس در نظام حقوق کیفری است. در این مقاله، به بررسی مبانی حقوقی و فلسفی مجازات کیفری از سوی هیئت منصفه کیفری پرداخته می‌شود. همچنین، به بررسی چالش‌ها و راهکارهای موجود در این زمینه پرداخته می‌شود.

1. دقت و وضوح در بیان موضوعات
2. استناد به منابع معتبر و به‌روز
3. رعایت اصول نگارش حقوقی

در سبب مجازات کیفری از سوی هیئت منصفه کیفری، یکی از مباحث مهم و حساس در نظام حقوق کیفری است. در این مقاله، به بررسی مبانی حقوقی و فلسفی مجازات کیفری از سوی هیئت منصفه کیفری پرداخته می‌شود. همچنین، به بررسی چالش‌ها و راهکارهای موجود در این زمینه پرداخته می‌شود.

در سبب مجازات کیفری از سوی هیئت منصفه کیفری، یکی از مباحث مهم و حساس در نظام حقوق کیفری است. در این مقاله، به بررسی مبانی حقوقی و فلسفی مجازات کیفری از سوی هیئت منصفه کیفری پرداخته می‌شود.

1. مبانی حقوقی مجازات کیفری از سوی هیئت منصفه کیفری
(نظریه کیفری) است. این نظریه بر این باور است که مجازات کیفری از سوی هیئت منصفه کیفری، یکی از مباحث مهم و حساس در نظام حقوق کیفری است.

2. مبانی فلسفی مجازات کیفری از سوی هیئت منصفه کیفری
این بخش به بررسی مبانی فلسفی مجازات کیفری از سوی هیئت منصفه کیفری پرداخته می‌شود. همچنین، به بررسی چالش‌ها و راهکارهای موجود در این زمینه پرداخته می‌شود.

3. مبانی حقوقی مجازات کیفری از سوی هیئت منصفه کیفری
این بخش به بررسی مبانی حقوقی مجازات کیفری از سوی هیئت منصفه کیفری پرداخته می‌شود. همچنین، به بررسی چالش‌ها و راهکارهای موجود در این زمینه پرداخته می‌شود.

4. مبانی حقوقی مجازات کیفری از سوی هیئت منصفه کیفری
این بخش به بررسی مبانی حقوقی مجازات کیفری از سوی هیئت منصفه کیفری پرداخته می‌شود. همچنین، به بررسی چالش‌ها و راهکارهای موجود در این زمینه پرداخته می‌شود.

ر. مبانی حقوقی مجازات کیفری از سوی هیئت منصفه کیفری
این بخش به بررسی مبانی حقوقی مجازات کیفری از سوی هیئت منصفه کیفری پرداخته می‌شود. همچنین، به بررسی چالش‌ها و راهکارهای موجود در این زمینه پرداخته می‌شود.

س. مبانی حقوقی مجازات کیفری از سوی هیئت منصفه کیفری
این بخش به بررسی مبانی حقوقی مجازات کیفری از سوی هیئت منصفه کیفری پرداخته می‌شود. همچنین، به بررسی چالش‌ها و راهکارهای موجود در این زمینه پرداخته می‌شود.

م. مبانی حقوقی مجازات کیفری از سوی هیئت منصفه کیفری
این بخش به بررسی مبانی حقوقی مجازات کیفری از سوی هیئت منصفه کیفری پرداخته می‌شود. همچنین، به بررسی چالش‌ها و راهکارهای موجود در این زمینه پرداخته می‌شود.

ن. مبانی حقوقی مجازات کیفری از سوی هیئت منصفه کیفری
این بخش به بررسی مبانی حقوقی مجازات کیفری از سوی هیئت منصفه کیفری پرداخته می‌شود. همچنین، به بررسی چالش‌ها و راهکارهای موجود در این زمینه پرداخته می‌شود.

4. «...»
 5. «...»
 6. «...»
 7. «...»
 8. «...»
 9. «...»
 10. «...»
 11. «...»

12. «...»
 13. «...»
 14. «...»
 15. «...»
 16. «...»
 17. «...»
 18. «...»
 1. «...»
 2. «...»
 3. «...»

3. מורה להודיע על כך בכתב ולעיתים רחוקות להודיע על כך בכתב או להודיע על כך בכתב.
4. מורה להודיע על כך בכתב ולעיתים רחוקות להודיע על כך בכתב או להודיע על כך בכתב.
5. מורה להודיע על כך בכתב ולעיתים רחוקות להודיע על כך בכתב או להודיע על כך בכתב.
6. מורה להודיע על כך בכתב ולעיתים רחוקות להודיע על כך בכתב או להודיע על כך בכתב.

7. מורה להודיע על כך בכתב ולעיתים רחוקות להודיע על כך בכתב או להודיע על כך בכתב.
8. מורה להודיע על כך בכתב ולעיתים רחוקות להודיע על כך בכתב או להודיע על כך בכתב.
9. מורה להודיע על כך בכתב ולעיתים רחוקות להודיע על כך בכתב או להודיע על כך בכתב.



מחשבוט המדינה
ד"ר
מחשבוט

30	עמודים	1433
21	דף	2012

1. מחשבוט המדינה
- מחשבוט המדינה

2. מחשבוט המדינה
- מחשבוט המדינה

